

# ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

તારીખ : ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૪, શુક્રવાર  
વિક્રમ સંવત ૨૦૮૦, પોષ વદ ચોદસ

વર્ષ : ૧૫  
અંક : ૧૮૯

તંત્રી : પટેલ સુરેશ રમણલાલ  
અમદાવાદ

કિંમત : રૂા. ૨.૦૦  
પાના : ૮

ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૦૭૯-૨૬૭૬૫૭૩૩ e-mail : cnngujarat@yahoo.com, cnngujarat@gmail.com RNI Reg. No. GUJGUJ/2009/28886

## RBIએ વ્યાજ દરમાં કોઈ ઘટાડો ન કર્યો, સસ્તી લોન માટે રાહ જોવી પડશે

। નવી દિલ્હી, તા.૮ । ભારતીય રિઝર્વ બેંક મોન્ટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કર્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાણકારી આપી છે. રેપો રેટ સતત છઠ્ઠી વખત ૬.૫ પર સ્થિર રાખવામાં આવ્યો છે. એટલે કે સામાન્ય લોકોને હજુ પણ સસ્તી લોન માટે રાહ જોવી પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ છેલ્લે રેપો રેટ વધાર્યો હતો. કેન્દ્રીય બેંકે છેલ્લે ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં ૨૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કરીને ૬.૫ ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં

યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ તેમાં ફેરફારની શક્યતા ઓછી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યા પછી આ પ્રથમ RBI MPCની બેઠક છે. નિષ્ણાતો માને છે કે આ બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે, RBI ગવર્નર શક્તિકાંત દાસ રેપો રેટને સ્થિર રાખી શકે છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્રીય બેંક એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ અને કુગાવાને નિયંત્રિત કરશે. નોંધનીય છે કે શક્તિકાંત દાસે પહેલેથી જ સંકેત આપ્યા હતા કે આગામી વર્ષમાં વિકાસ દર ૭ ટકાની આસપાસ રહી શકે છે, જ્યારે કુગાવાનો દર સરેરાશ ૪.૫ ટકાની આસપાસ રહેશે.

### મૂડી ખર્ચ વધતા રોકાણ ચક્રમાં ગતિ પકડી રહ્યું છે : દાસ

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની અર્થવ્યવસ્થા સાત ટકાના વિકાસ દરે વધવાનો અંદાજ મુક્યો છે. અગાઉ વર્તમાન નાણાકીય વર્ષમાં ૭.૩ ટકાનો અંદાજ મુકાયો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે દર બે મહિને યોજાતી મોન્ટરી પોલિસીની બેઠકમાં કહ્યું કે, ગ્રામીણ માંગમાં તેજી યથાવત્ છે, જ્યારે શહેરી વપરાશમાં મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને મૂડી ખર્ચ વધતા રોકાણ ચક્રમાં ગતિ પકડી રહ્યું છે. તેમણે કહ્યું કે, ખાનગી રોકાણમાં વધારો થવાનો સંકેત જોવા મળી રહ્યો છે.



### ૨૦૨૪-૨૫માં અર્થવ્યવસ્થા સાત ટકાના દરે વિકાસ કરશે

દાસે કહ્યું કે, સ્થાનિક આર્થિક ગતિવિધિઓમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (એનએસઓ)ના અંદાજ મુજબ, વર્તમાન નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર ૭.૩ ટકા છે. ગત નાણાકીય વર્ષની જેમ વર્તમાન નાણાકીય વર્ષમાં પણ ગતિ યથાવત્ રહેવાની આશા છે. ભારતનો વિદેશી હૂડિયામણ ભંડાર ૬૨૨.૫ અબજ ડોલર પર પહોંચી ગયો છે, જે તમામ વિદેશી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવામાં પર્યાપ્ત છે. આ અગાઉ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોન્ટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે માહિતી આપી છે. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટને સતત છઠ્ઠી વખત ૬.૫ પર સ્થિર રાખવામાં આવ્યા છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે કુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ છેલ્લે ૨૦૨૩ની ૮ ફેબ્રુઆરીએ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં ૨૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કરીને ૬.૫ ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.

### ન્યૂઝ ડિસ્ક

#### મનમોહનસિંહનું માર્ગદર્શન હંમેશા યાદ કરાશે : વડાપ્રધાન

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ । વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રાજ્યસભામાં પદ સાંસદોની વિદાયના અવસરે સંબોધનમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જે રીતે દેશનું માર્ગદર્શન કર્યું છે, તેમના યોગદાનને હંમેશા યાદ કરાશે. બરેબર તો રાજ્યસભામાં જે ૫૬ સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ સામેલ છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે હું ડૉ. મનમોહન સિંહ વિશે કંઈક બોલવા માગુ છું. ૬ વખત આ ગૃહમાં નેતા તરીકે અને વિપક્ષના નેતા તરીકે પણ તેમનું યોગદાન રહ્યું છે. વૈચારિક મતબેદ, ડિબેટમાં આક્ષેપ બાજુ એ થોડાક સમય માટે હોય છે. તેમણે આ ગૃહનું અને દેશનું માર્ગદર્શન કર્યું છે. જ્યારે પણ લોકતંત્રની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે. તેમના યોગદાનને લોકો યાદ કરશે. ડૉ. મનમોહનની પ્રશંસા કરતાં પીએમ મોદીએ કહ્યું કે ડૉ. મનમોહન સિંહે ગૃહનું અનેકવાર માર્ગદર્શન કર્યું. જ્યારે સાંસદોના યોગદાનની વાત થશે.

## કેન્દ્ર સરકાર યુપીએ શાસનના ૧૦ વર્ષ પર શ્વેત પત્ર ભાજપ સરકારના ૧૦ વર્ષ પર કોંગ્રેસ દ્વારા બ્લેક પેપર લવાયું

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ । સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના ૧૦ વર્ષના શાસન સામે શ્વેત પેપર લાવવા જઈ રહી છે ત્યારે જેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સરકારના ૧૦ વર્ષના શાસન સામે બ્લેક પેપર લાવી છે. ખડગેએ આ બ્લેક પેપર રજૂ કર્યો હતો. તેમણે આ દરમિયાન મોદી સરકારની ગેરન્ટીઓ, મોંઘવારી, ખેડૂતો વગેરેના મુદ્દાઓને ઊઠાવ્યાં હતાં. તેમણે આ દરમિયાન મોદી સરકારના ૧૦ વર્ષના શાસનને અન્યાય કાળ ગણાવતાં કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર ક્યારેય સત્ય જણાવતી નથી. એમએસપીની ગેરન્ટી આપી હતી જે આજ સુધી પૂરી થઈ નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ 'બ્લેક પેપર' રજૂ કરતાં ઘણાં મુદ્દાઓ પર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર વર્તમાન સમયની વાત નથી કરતી અને તે ભૂતકાળમાં જઈને કોંગ્રેસના શાસનની વાતો કરે છે. પરંતુ તેણે આજના સમયમાં જે મોંઘવારી છે તેની વાત કરવી જોઈએ. મોદીએ હાલમાં કુગાવાને કન્ટ્રોલ કરવા કેવા પગલાં ભર્યા તેના વિશે જણાવવું જોઈએ. તેમણે ઈન્દિરા ગાંધી અને નહેરુના સમયકાળની વાતો કરવાનું ટાળવું જોઈએ.



### ખડગેએ આ બ્લેક પેપર રજૂ કર્યો હતો

ખડગેએ મોદી સરકાર પર મોટો આરોપ મૂકતાં કહ્યું કે ઉદ્યોગપતિઓ, નેતાઓ સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને હેરાનગતિ કરીને ચૂંટણી માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર ઈડી, સીબીઆઈ, આઈટી અને અન્ય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ખડગેએ બ્લેક પેપર વાંચતા કહ્યું કે મોદી સરકાર કહે છે કે અમને પ્રજાનો સપોર્ટ છે. તો પછી શા માટે તમારે બીજા રાજ્યોમાં સરકારોને પાડીને તમારી સરકાર બનાવવાની ફરજ પડે છે.

### યુપીએની સરખામણીએ મોદી સરકારની કામગીરી દર્શાવશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ । કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેત પત્ર રજૂ કર્યું છે. જેમાં કોંગ્રેસની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવશે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે ઘણી મહેનત કરી છે. શ્વેત પેપર દ્વારા યુપીએ અને એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કામની સરખામણી કરવામાં આવશે. સરકાર તેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા સકારાત્મક પગલાંઓ વિશે પણ જણાવશે. શ્વેત પેપર એક એવો અહેવાલ છે, જેના દ્વારા સરકારની ઉપલબ્ધિઓ જણાવવામાં આવે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ 'બ્લેક પેપર' રજૂ કરતાં ઘણાં મુદ્દાઓ પર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર વર્તમાન સમયની



આજના સમયમાં જે મોંઘવારી છે તેની વાત કરવી જોઈએ. મોદીએ હાલમાં કુગાવાને કન્ટ્રોલ કરવા કેવા પગલાં ભર્યા તેના વિશે જણાવવું જોઈએ. તેમણે ઈન્દિરા ગાંધી અને નહેરુના સમયકાળની વાતો કરવાનું ટાળવું જોઈએ. તેમની સાથે તુલના ન થઈ શકે. વાત નથી કરતી અને તે ભૂતકાળમાં જઈને કોંગ્રેસના શાસનની વાતો કરે છે.

## શ્વેતપત્રની પરંપરા ૧૯૨૨માં બ્રિટિશ સરકારે શરૂ કરી હતી યુપીએ શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પડાયું

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ । સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન, સરકાર સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પાડ્યું છે. આ શ્વેતપત્રમાં સરકાર દેશની અર્થવ્યવસ્થા પર ૨૦૧૪ પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની હાનિકારક અસરો વિશે વિગતવાર જણાવશે. કેન્દ્ર સરકાર આ શ્વેતપત્ર ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ એટલે કે રવિવારે લાવી શકે છે. સંસદના બજેટ સત્રનો આ છેલ્લો દિવસ હશે. પ્રથમ બજેટ સત્ર ૯ ફેબ્રુઆરીએ પૂરું થવાનું હતું, પરંતુ તેને એક દિવસ લંબાવવામાં આવ્યું છે. શ્વેતપત્ર ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું, તેનો અર્થ શું છે અને તેનો ઉપયોગ શા માટે થાય છે? એ જાણીએ. ૧૦૨ વર્ષ પહેલા એટલે કે ૧૯૨૨ માં શ્વેતપત્રની

પરંપરા બ્રિટિશ સરકારે શરૂ કરી હતી. શ્વેતપત્ર એક સરકાર, કંપની કે બિન-લાભકારી સંસ્થા દ્વારા ઉકેલ, ઉત્પાદન અથવા સેવાની વિશેષતાઓને પ્રોત્સાહન આપવા પ્રકાશિત કરવામાં આવેલ માહિતી દસ્તાવેજ છે. શ્વેતપત્રનો ઉપયોગ જાહેર અભિપ્રાયનું મૂલ્યાંકન કરવાની તેમજ સરકારી નીતિઓ અને કાયદાઓ રજૂ કરવાની પદ્ધતિ તરીકે થાય છે. શ્વેતપત્ર કોઈપણ વિષય પર પ્રાપ્ત માહિતી અથવા સર્વેક્ષણનો એક ભાગ છે. સરકારની સાથે કોઈપણ સંસ્થા કે કંપની દ્વારા શ્વેતપત્ર જાહેર કરી શકાય છે. શ્વેતપત્રમાં તેના ગ્રાહકો કર્મચારીઓ અથવા જનતાને તેની પ્રોડક્ટ વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે. આ સાથે ઘણી સંસ્થાઓ તેમના દ્વારા રજૂ કરાયેલી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે શ્વેતપત્રો બહાર પાડે છે. આ રીતે માહિતી સામાન્ય લોકો

સુધી પહોંચાડવામાં આવે છે. આર્થિક બાબતોને લગતા શ્વેતપત્રોમાં સરકાર અથવા કોઈપણ સંસ્થાની ખામીઓ, તેની સંબંધિત આડઅસરો અને સુધારા માટેના સૂચનો જેવા વિષયો હોય છે. જ્યારે ઉત્પાદન/ટેકનોલોજી સંબંધિત શ્વેતપત્રમાં તેના વિશેની માહિતી હોય છે. તેમના તાજેતરમાં રજૂ કરાયેલા વચગાળાના બજેટ ૨૦૨૪માં, નાણામંત્રી નિર્મલા સીતારમણે યુપીએ સરકાર દરમિયાન લેવામાં આવેલા આર્થિક નિર્ણયો અને દેશ પર તેની પ્રતિકૂળ અસરો અંગે શ્વેતપત્ર લાવવાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ તેમના વચગાળાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે જ્યારે આ સરકારે વર્ષ ૨૦૧૪ માં સત્તા સંભાળી ત્યારે અર્થવ્યવસ્થાને અને ગવર્નન્સ સિસ્ટમને તબક્કાવાર સુધારવાની જવાબદારી ખૂબ મોટી હતી.



વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આચાર્ય શ્રીલ પ્રભુપાદજીને પુષાંજલિ અર્પણ કરી હતી.

સમાચાર પત્ર છે લોકતંત્રનો ચૌથો સ્તંભ અને પ્રાણ, જે કહે છે એક લોકતંત્રનો નિર્માણ !

CHANNEL NINE NETWORK GUJARAT

◆ ન્યૂઝ પેપર, ◆ ન્યૂઝ ચેનલ, ◆ ન્યૂઝ વેબસાઈટ

આજે જ [cnngujarat.com](http://cnngujarat.com) વેબસાઈટ ઉપર વિમીટ કરો અને જોડાઈ જાઓ સમાચારની દુનિયા સાથે...

LIVE [cnngujarat.co.in](http://cnngujarat.co.in)

**મોલાનાના ટ્રસ્ટમાં એક સાથે જમા થયા હતા પર લાખ રૂપિયા**

। (એજન્સી) જુનાગઢ, તા.૮ । એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જુનાગઢ પોલીસ દ્વારા મુંબઈના ઘાટકોપરના રહેવાસી મોલાના સલમાન અહમદની સહિતના ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા ગુનાના કામે રજીસ્ટર્ડ કરવામાં આવેલા કેસમાં આઈપીસીની કલમ ૪૪૭, ૪૬૫, ૪૭૧નો ઉમેરો કરાવવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસ દ્વારા વધારાના રિમાન્ડ માંગવામાં ન આવતા કોર્ટમાં બચાવ પક્ષના વકીલ દ્વારા ત્રણેય આરોપીઓની જામીન અરજી કરવામાં આવી હતી. જ્યારે આરોપીઓને જામીન આપવા ન આવે તે માટે બાર મુદ્દાઓ કોર્ટના ધ્યાન પર મુકવામાં આવ્યા હતા. જો કે કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના શારતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જે અંતગત આરોપીઓને અગાઉ સીઆર પીસી ૪૧ (૧) મુજબ નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં તેમના દ્વારા સહકાર આપવામાં નહોતો આવ્યો. સલમાન અહમદની મુંબઈ ખાતે ધરપકડ કરવા જતા તેમના સમર્થકો દ્વારા ઘાટકોપર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી પોલીસ ઉપર દબાણ લાવવાનો તેમજ આરોપીને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે અંતગત મહારાષ્ટ્ર પોલીસ દ્વારા લોકો ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. તેમજ ઘાટકોપર પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. સલમાન અહમદની અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના બેક એકાઉન્ટની માહિતી દરમિયાન ૨૦૨૩ માં પર લાખ જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. જે રકમ કોના કોના દ્વારા જમા કરાવવામાં આવી છે તે બાબતની તપાસ ચાલુ છે. જે બેક એકાઉન્ટમાંથી સેલ્ફ તરીકે ૨૭ લાખ ૭૫ હજાર રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જે રોકડ રકમનો તેને કઈ રીતે ઉપયોગ કર્યો છે તે બાબતની તપાસ ચાલુ છે. સલમાન અહમદ દ્વારા ૨૦૨૨થી અત્યાર સુધીમાં કયા કયા વિદેશ પ્રવાસ કરેલવામાં આવેલ છે તે બાબતની માહિતી રિજીસ્ટ્રેશન પાસ પોર્ટ ઓફિસ ખાતેથી મંગાવવામાં આવી છે. આરોપી મહંમદયુસુફ મલેક અને અઝીમ ઓડેદરાના રિમાન્ડ દરમિયાન મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. જે ડેટા મેગવનાની કામગીરી ચાલુ છે. આરોપીઓ દ્વારા અલ અઝીમ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢના નેજા હેઠળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટ્રસ્ટ અંગે અઝીમની પૂછપરછ કરતા તે ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયેલ ન હોવાનું સામે આવ્યું છે. જેથી ચેરીટી કમિશનર પાસેથી આ બાબતની માહિતી પણ માંગવામાં આવી છે.



અમદાવાદના વસ્ત્રાપુર રેલવે ફાટક ખુલતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જઈ હતી.

**ભુજમાં છેલ્લા ૩૨ વર્ષથી હોસ્પિટલ રોડ પર બિલકુલ દાબેલીના નામે ધીરુભાઈ ચંદેની લારી આવેલી છે કચ્છમાં કચ્છી દાબેલી ખાવા લોકોની અસંખ્ય ભીડ લાગે છે**

। (એજન્સી) કચ્છ, તા.૮ । દરેક પ્રદેશની એક પોતાની આગવી ખાસિયત અને વાનગી ઓળખાતી હોય છે. કચ્છમાં અનેક ફાસ્ટ ફૂડ વખણાય છે, જેમાંથી સૌથી વધારે પ્રખ્યાત છે 'કચ્છી દાબેલી'. કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ ફાસ્ટ ફૂડને જરૂરથી ટેસ્ટ કરે છે. દેશના કોઈ પણ ખૂણે ફાસ્ટ ફૂડ રસીકોમાં પણ દાબેલી તો વખણાય જ છે. દાબેલીની સૌપ્રથમ શરૂઆત કચ્છના માંડવી તાલુકામાં વર્ષ ૧૯૯૦માં થઈ હતી. માંડવીના ગાભાભાઈની દાબેલી શરૂઆતથી હજી સુધી પણ વખણાય છે. ત્યારે તેમણે ૬ પૈસામાં દાબેલી વેચવાનું શરૂ કર્યું હતું અને આજે આ તેઓ ૨૦ થી ૨૫ રૂપિયામાં વેચે છે. કચ્છી ફૂડ અને ફરસાણને દેશ-વિદેશી પ્રવાસીઓને ઘેલું લગાડ્યું છે. માંડવીથી



શરૂઆત થઈને અંજાર, ભુજ સહિત ગાંધીધામ દરેક જગ્યાએ દાબેલી મળે છે અને ખાસ સ્વાદ રસિકો એક વખત જો કચ્છી વ્યંજનને ચાખે તો તેનો ટેસ્ટ જરૂરથી દાબેલી જાવ જોઈએ. સામાન્ય રીતે કચ્છનું નામ પડે એટલે કચ્છી દાબેલી અને ડબલ રોટી અચૂકથી યાદ આવી જ જાય. આ દાબેલીનું જન્મ બંદરેય નગર માંડવીમાં થયું હતું. કચ્છીઓનો જગવિખ્યાત બનેલા આ ફાસ્ટ ફૂડની લારીઓમાં દરરોજ સાંજે લોકોની

ભીડ જોવા મળે છે. શરૂઆતમાં લંબચોરસ એ વાત ચોક્કસ આકારના પાઉંમાં બાફેલા બટાકાનું શાક, તેમાં લસણની ચટણી અને આમલીની ખાટી ચટણી ભરીને તેનો આવિષ્કાર થયો હતો અને આજે કચ્છના ગામેગામ અને દરેક શહેરમાં દાબેલીની લારીઓ નજરે પડે છે. ભુજમાં છેલ્લા ૩૨ વર્ષથી હોસ્પિટલ રોડ પર 'બિલકુલ દાબેલી'ના નામે ધીરુભાઈ ચંદેની લારી આવેલી છે, જ્યાં લોકોને અસંખ્ય ભીડ ફક્ત રવિવારે નહીં, પરંતુ દરરોજ જોવા મળે છે. કચ્છની ફેમસ દાબેલી ઘરે પણ બનાવી શકાય છે. આ દાબેલીનો મસાલો બજારમાં સહેલાઈથી મળી જાય છે. બટાકાને બાફીને તેમાં આ દાબેલીના મસાલાને ઉમેરવામાં આવે છે અને પાઉંને વચ્ચેથી કાપીને તેમાં મસાલો ઉમેરવામાં આવે છે.

**ગાંધીનગરમાં બિલ્ડર ગુપના ૨૭ સ્થળોએ આઈટીના દરોડા**

। (એજન્સી) ગાંધીનગર, તા.૮ । ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બિલ્ડર ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. એકસાથે ૨૭ જેટલા સ્થળે આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ ઓફિસો અને નિવાસ્થાને તપાસ કરી રહ્યા છે. ગુજરાતમાં અગાઉ પણ અનેક બિલ્ડરો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે ત્યારે આજે ગાંધીનગરમાં પીએસવાય બિલ્ડર ગ્રૂપ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

**શેઠ એલ.જી. જનરલ હોસ્પિટલ અમદાવાદ ખાતે અમદાવાદ જિલ્લાનું સૌ પ્રથમ એડિક્શન ટ્રિટમેન્ટ ફેસિલિટી સેન્ટર (ATF CENTRE)નું લોકાર્પણ**



। (માહિતી) અમદાવાદ, તા.૮ । નશાના કારણે યુવા ધન અને આવનારી પેઢી બરબાદ ન થાય તેવા ઉમદા હેતુથી ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય AIMS દિલ્હીની સાથે મળીને સમાજમાં નશાના દુષ્પણને અટકાવવા સારવાર કરવા અને નશા કરતા વ્યક્તિઓને સમાજમાં મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની જાગૃતાનું કાર્ય કરે છે. આ અવરનેસ અંતગત ૮ ફેબ્રુઆરી ગુરુવારના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ. વીરેન્દ્ર કુમાર, વરદ હસ્તે ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર જનપથ - ન્યુ દિલ્હીથી વર્ચ્યુઅલ મોડ દ્વારા સમગ્ર દેશના કુલ ૪૧ એડિક્શન ટ્રિટમેન્ટ

**તલ, કપાસ અને ચણા સહિતના પાકની થઈ આવક**

। (એજન્સી) બોટાદ, તા.૮ । માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ તલની આજે ૨૫૦ મણ આવક થઈ હતી, જેના ભાવ પ્રતિ મણ સૌથી નીચા ભાવ ૨,૫૦૫ રૂપિયા નોંધાયો હતા. જ્યારે સૌથી ઉંચા ભાવ ૨,૮૫૦ રૂપિયા નોંધાયો હતો. ગત છેલ્લા દિવસનો ભાવ પ્રતિ મણ ૨,૮૩૦ રૂપિયા નોંધાયો હતો. છેલ્લા બે દિવસમાં સરેરાશ ૮૦ રૂપિયાનો પ્રતિ મણ ભાવ ઘટાડો નોંધાયો હતો. યાર્ડ ખાતે કપાસની કુલ ૩૮,૨૮૦ મણ આવક નોંધાઈ હતી. કપાસનો પ્રતિ મણ સૌથી નીચો ભાવ ૧,૧૧૧ રૂપિયા નોંધાયો હતો, જ્યારે સૌથી ઉંચો ભાવ ૧,૪૮૮ રૂપિયા નોંધાયો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોએ જણાવી વેચવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતા બોટાદ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઉંચો અને આવકના પ્રમાણમાં વધુ હોય છે. છેલ્લા ત્રણ દિવસ પૈકી આજે સરેરાશ કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રની સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. આજે યાર્ડમાં ચણાની ૧૨૫ કિવન્ટલ આવક થઈ હતી, જેના એક મણના સૌથી નીચા ભાવ ૮૦૦ રૂપિયા સુધી રહ્યા હતા અને એક મણના સૌથી ઉંચા ભાવ ૧,૧૦૦ રૂપિયા સુધીના રહ્યા હતા. જ્યારે છેલ્લા દિવસે ચણાની ૧૮૦ કિવન્ટલ આવક નોંધાઈ હતી. આજરોજ ૧૨૫ કિવન્ટલ આવક નોંધાતા ચણાની એકંદરે આવકમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા દિવસે ચણાનો પ્રતિ મણ ભાવ ૧,૫૧૫ રૂપિયા નોંધાયો હતો.

**વેલેન્ટાઈન ડે પર માર્કેટમાં અવનવી ગિફ્ટઓએ આકર્ષણ જમાવ્યું વેલેન્ટાઈન ડે પર બનાસકાંઠાના બજારમાં પ્રેમીઓ કરી રહ્યા છે અલગ ગિફ્ટની માંગ**

વેલેન્ટાઈન ડે પર માર્કેટમાં અવનવી ગિફ્ટઓએ આકર્ષણ જમાવ્યું વેલેન્ટાઈન ડે પર બનાસકાંઠાના બજારમાં પ્રેમીઓ કરી રહ્યા છે અલગ ગિફ્ટની માંગ વેલેન્ટાઈન વીક ૭ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરીમાં આવતું અઠવાડિયું પ્રેમીઓ માટે ખાસ હોય છે. । (એજન્સી) બનાસકાંઠા, તા.૮ । વેલેન્ટાઈન ડે ૧૪મી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે પર લવ પ્રેમ કરનારાઓ માટે ખૂબ જ ખાસ હોય છે. કોઈ પોતાના લવ પાર્ટનર માટે આ દિવસને ખાસ બનાવતા હોય છે. તેમજ ઘણા લોકો અલગ ગિફ્ટ આપી પોતાની લાગણી વ્યક્ત કરે છે. ત્યારે બનાસકાંઠામાં આ વર્ષે વેલેન્ટાઈન ડે પર માર્કેટમાં કઈ ખાસ નવી વસ્તુઓ આવી છે. તેમજ લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેલેન્ટાઈન વીક ૭ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરીમાં આવતું અઠવાડિયું પ્રેમીઓ માટે ખાસ હોય છે. આ વીકમાં દરરોજ એક ખાસ દિવસ રીતે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે બનાસકાંઠામાં પણ વેલેન્ટાઈન ડે ને લઈ માર્કેટમાં અલગ અલગ અવનવી ડિઝાઈન વાળી ગિફ્ટઓ પણ આવી ગઈ છે. લોકો પણ વેલેન્ટાઈન ડે પર લવ પાર્ટનર માટે ગિફ્ટ આર્ટિકલમાં અલગ અલગ અવનવી ગિફ્ટ લેવા મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે પર લવ પ્રેમ કરનારાઓ માટે ખૂબ જ ખાસ હોય છે. કોઈ પોતાના લવ પાર્ટનર માટે આ દિવસને ખાસ બનાવતા હોય છે. તેમજ ઘણા લોકો અલગ ગિફ્ટ આપી પોતાની લાગણી વ્યક્ત કરે છે. ત્યારે બનાસકાંઠામાં આ વર્ષે વેલેન્ટાઈન ડે પર માર્કેટમાં કઈ ખાસ નવી વસ્તુઓ આવી છે. તેમજ લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેલેન્ટાઈન વીક ૭ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરીમાં આવતું અઠવાડિયું પ્રેમીઓ માટે ખાસ હોય છે. આ વીકમાં દરરોજ એક ખાસ દિવસ રીતે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે બનાસકાંઠામાં પણ વેલેન્ટાઈન ડે ને લઈ માર્કેટમાં અલગ અલગ અવનવી ડિઝાઈન વાળી ગિફ્ટઓ પણ આવી ગઈ છે. લોકો પણ વેલેન્ટાઈન ડે પર લવ પાર્ટનર માટે ગિફ્ટ આર્ટિકલમાં અલગ અલગ અવનવી ગિફ્ટ લેવા મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે પર લવ પ્રેમ કરનારાઓ માટે ખૂબ જ ખાસ હોય છે. કોઈ પોતાના લવ પાર્ટનર માટે આ દિવસને ખાસ બનાવતા હોય છે. તેમજ ઘણા લોકો અલગ ગિફ્ટ આપી પોતાની લાગણી વ્યક્ત કરે છે. ત્યારે બનાસકાંઠામાં આ વર્ષે વેલેન્ટાઈન ડે પર માર્કેટમાં કઈ ખાસ નવી વસ્તુઓ આવી છે. તેમજ લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેલેન્ટાઈન વીક ૭ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરીમાં આવતું અઠવાડિયું પ્રેમીઓ માટે ખાસ હોય છે. આ વીકમાં દરરોજ એક ખાસ દિવસ રીતે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે બનાસકાંઠામાં પણ વેલેન્ટાઈન ડે ને લઈ માર્કેટમાં અલગ અલગ અવનવી ડિઝાઈન વાળી ગિફ્ટઓ પણ આવી ગઈ છે. લોકો પણ વેલેન્ટાઈન ડે પર લવ પાર્ટનર માટે ગિફ્ટ આર્ટિકલમાં અલગ અલગ અવનવી ગિફ્ટ લેવા મનાવવામાં આવે છે.

**વિશેષ પ્રભાસતીર્થની પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે પ્રકારની સફાઈ જાળવીએ : કલેક્ટરશ્રી**

**કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન**



। (માહિતી) ગીર સોમનાથ । 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના સુત્રને સાથક કરતા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે કલેક્ટરશ્રીના વડપણ હેઠળ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કમિટીઓએ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી, પ્લાસ્ટિકની કોથળીઓ, લાકડાના ઝીણાં ટૂકડાઓ, થર્મોકોલના નકામા ટૂકડાઓ વગેરેની સફાઈ કરી સમગ્ર રોડને ચોખ્ખોચણાક બનાવ્યો હતો. કલેક્ટરશ્રી દ્વારા રસ્તા પર નડતરપૂર્ણ બાવળ દૂર કરવા, વધી ગયેલી ડાળીઓ કાપવા, પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા, કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતાં નોટિસબોર્ડ મૂકવા, જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી. કલેક્ટરશ્રીએ સફાઈ અંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, પ્રભાસતીર્થ એ પવિત્ર ભૂમિ છે. અખૂટ ઉર્જાનો અહેસાસ કરાવતી આ સાત્ત્વિક ભૂમિમાં કુદરતી સંપત્તિ એ ઈશ્વરની અમૂલ્ય દેણ છે. તમામ લોકો આ કુદરતી સંપત્તિની જાળવણી કરવામાં તેમજ દૈનિક ધોરણે સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપે, જેથી બહારથી આવતા પ્રવાસીઓ પણ ગીર સોમનાથની સારી છાપ લઈને પરત ફરે. આ સફાઈ કામગીરીમાં નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી ચેતન ડુડિયા, સેનિટેશન સમિતિ ચેરમેન શ્રી રાજુભાઈ ગઢિયા, સેનેટરી ઈન્સ્પેક્ટર શ્રી હરદિપસિંહ ખેર, બાબુભાઈ ટિંબાણિયા સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ જોડાયા હતાં.

દિલ્હીમાં ખેડૂતો પોતાની માગને લઈને સંસદ ભવન તરફ ફૂચ

# દિલ્હી-નોઈડા સરહદ પર ખેડૂત-પોલીસ વચ્ચે ઘર્ષણ

દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને મોટી સંખ્યામાં પોલીસ દળો દ્વારા ખેડૂતોને અટકાવાયા

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ । દિલ્હીમાં ખેડૂતો પોતાની માગને લઈને સંસદ ભવન તરફ ફૂચ કરી છે. તેને ધ્યાનમાં રાખીને નોઈડામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. ખેડૂતો નોઈડામાં મહામાયા ફ્લાયઓવરથી આગળ વધ્યા હતા. દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને મોટી સંખ્યામાં પોલીસ દળો દ્વારા ખેડૂતોને અટકાવ્યા છે. ખેડૂતો પણ હડતાળ પર બેઠા છે અને દિલ્હી જવાની માગ પર અડગ છે. જો કે, હડતાળ પર બેઠેલા ખેડૂતોની પોલીસે અટકાવતી કરી હતી. ખેડૂતોએ સંસદ ભવનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતોની મહાપંચાયત અને દિલ્હી ફૂચને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. પોલીસના જણાવ્યા

અનુસાર, 'કેટલીક જગ્યાએ રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. દિલ્હી અને નોઈડાને જોડતા રસ્તાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.' ખેડૂતો ગ્રેટર નોઈડા ઓથોરિટીની બહાર ઘણાં દિવસોથી દેખાવ કરી રહ્યા છે. તેઓએ ગુરુવારે ઘેરાબંધીની તૈયારી કરી લીધી છે. ખેડૂતોએ કહ્યું હતું કે, 'દિલ્હી ફૂચમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાશે.' ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ અનુસાર, 'મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (એમએસપી) માટેની કાયદાકીય ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવા, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, ખેડૂતોની લોન માફી, પોલીસ કેસ પાછા ખેંચવાની અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાયની માગ કરવામાં આવી છે.'



## ન્યૂઝ ડિસ્ક આચારસંહિતા પહેલાં જ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી દેવાશે

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ । કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપતાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ દેશમાં સેટેલાઈટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી દેવાશે. એવું મનાય છે કે આગામી લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા માર્ચના પ્રથમ સપ્તાહમાં લાગુ થઈ જશે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે સંસદને ખાતરી આપવા માંગીએ છીએ કે ટોલ સિસ્ટમ માટે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી સેટેલાઈટ આધારિત સિસ્ટમ ટૂંક સમયમાં રજૂ કરાશે. ટોલનાકા પણ હટાવી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે હવેથી નવી જીપીએસઆધારિત ટોલ સિસ્ટમ આવી જવાથી લોકોએ રોકવાની જરૂર નહીં પડે અને નંબર પ્લેટના કોડા પરથી ટોલ વસૂલ કરી લેવાશે. આ સિસ્ટમ હાઈવે અથવા એક્સપ્રેસ વેનો કેટલા સમય માટે ઉપયોગ થયો તેના આધારે ટોલ વસૂલી કરશે. ટોલ ફી ડ્રાઈવરના બેંક ખાતામાંથી આપોઆપ કપાઈ જશે. દરમિયાન, ફાસ્ટગેટથી ટોલ ટેક્સ વસૂલીનો ડેટા શેર કરતી વખતે ગડકરીએ કહ્યું કે અત્યાર સુધી ફાસ્ટગેટથી ૪૮ હજાર કરોડ રૂપિયાથી વધુનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે.

## યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ, પ નોસેનિકો સવાર હતા



। (એજન્સી) સાન ડિયાગો, તા.૮ । યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. બયાવ ટીમ આ હેલિકોપ્ટરની શોધ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટર સીએચ-૫૩ઈસુપર સ્ટેલિયન છે. સાન ડિએગો નજીકના મરીન કોર્પ્સ એર સ્ટેશન મીરામર દ્વારા બુધવારે આ હેલિકોપ્ટર ગાયબ થયાની જાણ કરવામાં આવી હતી. હેલિકોપ્ટરમાં પાંચ મરીન મુસાફરી કરી રહ્યા હતા. હેલિકોપ્ટરે લાસ વેગાસ નજીકના એરબેઝ પરથી ઉડાન ભરી હતી. સાન ડિએગો કાઉન્ટી શેરિફ વિભાગ શોધમાં મદદ કરી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સ્થાનિક સમય અનુસાર સવારે ૨:૨૦ વાગ્યે ગુમ થયેલા હેલિકોપ્ટર અંગે ફાયર ફાઈટર્સને એલર્ટ કરવામાં આવ્યા હતા. બયાવ કર્મીને કેલિફોર્નિયાના લેક મરિના નજીકના વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. જો કે, તેઓને હેલિકોપ્ટર કે તેમાં સવાર મરીન મળ્યા ન હતા. આ સમગ્ર બયાવ કાર્યમાં સૌથી મોટી સમસ્યા ભારે હિમવર્ષા અને ઠંડી છે. જેના કારણે રેસ્ક્યુ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં હિમવર્ષા વચ્ચે આ ઘટના બની છે. પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને કેટલાક ઈંચ હિમવર્ષાના અહેવાલ છે.



નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિદ્ધતા કા અમૃત મહોત્સવ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા હતાં.

## ઈ-કોમર્સ કંપનીઓ માટે મોટો પડકાર સરકારી રાશનની દુકાનો કન્ટ્રીયુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ ઓન લાઈન વેચશે ઓએનડીસીપર પીડીએસ દુકાનો દ્વારા કન્ટ્રીયુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સને ઓનલાઈન વેચવાની યોજનાનું પરીક્ષણ કરાય છે

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ । આગામી દિવસોમાં ઈ-કોમર્સ કંપનીઓને પીડીએસ દુકાનોની આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જે માટે સરકારે નવી યોજના બનાવી છે. સરકાર તપાસ કરી રહી છે કે શું સરકારી રાશનની દુકાનો એટલે કે પીડીએસની દુકાનો કન્ટ્રીયુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ ઓનલાઈન વેચી શકે છે. ઓએનડીસીએ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. એક સમાચારપત્રના અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર ઓએનડીસીપર પીડીએસ દુકાનો દ્વારા કન્ટ્રીયુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સને ઓનલાઈન વેચવાની યોજનાનું પરીક્ષણ કરી રહી છે. ઓએનડીસીએ ઈ-કોમર્સના

યુપીઆઈટરીકે ઓળખાય છે. તેનો હેતુ ઈ-કોમર્સમાં ખાનગી કંપનીઓનું વર્ચસ્વ ખતમ કરવાનો છે. પીડીએસ દુકાનો એટલે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકાર હાલ રાશન એટલે કે અનાજ અને અન્ય ચીજવસ્તુઓ વેચે છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે હવે પીડીએસ દુકાનો દ્વારા કન્ટ્રીયુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ વેચાણનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ પરીક્ષણ હિમાચલ પ્રદેશના ઉના અને હમીરપુર જિલ્લામાંથી શરૂ કરવામાં આવ્યું છે. જો કેન્દ્ર સરકારનું આ પરીક્ષણ સફળ થશે તો આવનાર દિવસોમાં પીડીએસની દુકાનોમાંથી લોકો ઓનલાઈન ટૂથબ્રશ, સાબુ અને શેમ્પૂ જેવા કન્ટ્રીયુમર ડ્યુરેબલ સામાન ખરીદી શકશે.

## એનજેસીએના અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવાયો જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા કેન્દ્રને છ સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું જો આ સમયગાળાની અંદર નિર્ણય નહીં લેવાય તો દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની ચિમકી આપી છે

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ । કેન્દ્રીય કર્મચારીઓ એ દેશમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારને છ અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયગાળાની અંદર નિર્ણય નહીં લેવાય તો દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની ચિમકી આપી છે. આજે નવી દિલ્હીમાં યોજાયેલી નેશનલ જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શન (એનજેસીએ)ના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. એનજેસીએના સંયોજક શિવગોપાલ મિશ્રાએ બેઠકની અધ્યક્ષતા કરી છે. બેઠકમાં જણાવાયું કે, અનિશ્ચિતકાળ માટેની હડતાળની નોટિસ આપવા

અને હડતાળની તારીખ જાહેર કરવા બે દિવસની અંદર કમિટીની રચના કરાશે. કેન્દ્રીય તેમજ વિવિધ રાજ્ય સરકારોના કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા ગત વર્ષથી આંદોલન કરી રહ્યા છે. આ માટે ગત વર્ષે ચાર રેલી પણ યોજાઈ હતી. કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ વાત પહોંચાડવા વિવિધ પ્રયાસો કર્યા છે. ઓપીએસ માટે રચાયેલી એઆઈટીએફના સંચાલન સમિતિના વરિષ્ઠ સભ્ય અને એઆઈટીએફના મહાસચિવ શ્રી. શ્રીકુમારે કહ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા ઓપીએસ લાગુ કરવામાં નહીં આવે તો ભાજપે ગંભીર પરિણામ ભોગવવું પડશે.

## જૂઠા આરોપોથી પતિને ફસાવનારી મહિલાને પાંચ વર્ષની કેદની સજા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીનું ૪૮ વર્ષ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું

। (એજન્સી) ચેન્નાઈ, તા.૮ । આપણા દેશમાં સ્ત્રીઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડવાની સાથે તેમનું સમ્માન જળવાય તે માટે અનેક પ્રકારના કડક કાયદા છે, પરંતુ ક્યારેક આવા કાયદાનો દુરુપયોગ પણ થાય છે જેનો ભોગ મોટાભાગે પુરુષોને જ બનવાનો વારો આવતો હોય છે. આવા જ એક કેસમાં પોતાના પતિ પર સાવ નીચ કક્ષાનો કડક શકાય તેવો જૂઠો આરોપ મૂકી તેને ફસાવવાની કોશિશ કરનારી એક મહિલાને કોર્ટે પાંચ વર્ષની

જેલની સજા ફટકારી છે. ચેન્નાઈમાં બનેલી આ ઘટનામાં આજથી છ વર્ષ પહેલા આરોપ વયની મહિલાએ તેના પતિ પર પોતાની દીકરીને પ્રેગનેન્ટ કરવાનો આરોપ મૂક્યો હતો, અને તેની સાબિતી માટે લેબ રિપોર્ટને પણ પ્રુફ તરીકે રજૂ કર્યો હતો. જોકે, ચેન્નાઈ પોક્સો કોર્ટમાં મહિલાએ રજૂ કરેલા રિપોર્ટ સહિતના અમુક પુરાવા ફેક હોવાનું પુરવાર થતાં કોર્ટે તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. પત્નીએ મૂકેલા જૂઠા આરોપને કારણે તેના પતિને આગોતરા જામીન

લેવા મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરવી પડી હતી, અને ત્યારબાદ તેણે પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરાવવા પણ પિટિશન કરી હતી. આ કેસની ગંભીરતા જોતા હાઈકોર્ટે પણ તેના પર ખાસ ધ્યાન આપીને મહિલા દ્વારા રજૂ કરાયેલા પુરાવાની ઝીણવટભરી તપાસ કરવા આદેશ આપ્યો હતો. જેમાં એવું બહાર આવ્યું હતું કે પતિ પર જૂઠો આરોપ મૂકનારી મહિલા અગાઉ જે લેબમાં કામ કરતી હતી તે જ લેબમાં તેણે પોતાની દીકરીના ફેક રિપોર્ટ કઢાવ્યા હતા.

। (એજન્સી) મુંબઈ, તા.૮ । લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ આજે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સિદ્દીકીએ રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે 'હું નાનો હતો ત્યારે કોંગ્રેસમાં જોડાયો હતો અને આજે ૪૮ વર્ષ બાદ પાર્ટી છોડી રહ્યો છું. મારી આ યાત્રા ખૂબ જ શાનદાર રહી.' મિલિંદ દેવરા બાદ બાબા સિદ્દીકી પાર્ટી છોડનારા બીજા મોટા કોંગ્રેસી નેતા બન્યા છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે મુંબઈના બાંદ્રા ઈસ્ટના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી અજિત પવારની આગેવાની હેઠળના એનસીપીજૂથમાં સામેલ થઈ શકે છે.

### જાનકી ટ્રેડર્સ

**FinOlex PIPES**  
NILKANTH STEEL

**JK SUPER CEMENT**  
BUILD SAFE

BUILD SAFE  
#YehPoccaHai

**નેહલ મહેતા M :- 97261 06200 nehalmehta81.nm@gmail.com**

**સીમેન્ટ, ટીએમટી લોખંડ, ઓગલ, પાઈપ્સ, પતરા વગેરે દરેક જાતનું બીલ્ડીંગ મટીરીયલ અમારા ત્યા વ્યાજબી ભાવે મળશે... અવશ્ય મુલાકાત લો....**

**ગજા સિનેમા પાસે, પ્રતાપપુરા, ઉબરેલી રોડ, સંતરામપુર, જિલ્લા-મહિસાગર**

### MAMTA SOLUTION

**House Keeping નો કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે,**  
**House Keeping સંભાળ કરીએ છીએ.**

- ↳ લેબર કોન્ટ્રાક્ટ કરીએ છીએ
- ↳ લેબર જોતા હોય તો કોલ કરો
- ↳ કોઈ પણ કંપનીને લેબરની જરૂરીયાત હોય તો કોલ કરો.

**લેબર (લેડીઝ/જેન્ટલ) છોકરાઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે.**

લેબરને તમામ પ્રકારની ફેસિલીટી આપવામાં આવે છે, જેવી કે મેડિકલ/ખાવા-પીવાનું/રહેવાનું આપવામાં આવે છે.

**88 66 21 7393**

તંત્રી લેખ...

ચૂંટણીના એક દિવસ પહેલા પાકિસ્તાનમાં બ્લાસ્ટ થયા

પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બલુચિસ્તાનના બે વિસ્તારોમાં બ્લાસ્ટ થયા હતા. જેમાં કુલ ૨૨ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બલુચિસ્તાનના કાર્યકારી માહિતી પ્રધાન જાન અયકઝાઈએ પાકિસ્તાની ન્યૂઝને જણાવ્યું હતું કે પિશિન જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ મોટરસાઈકલ સાથે જોડાયેલ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED)નું પરિણામ હતું. જ્યાં કુલ ૧૨ લોકોના મોત થયા હતા. જ્યારે બીજો બ્લાસ્ટ બલુચિસ્તાન પ્રાંતના કિલા સૈફુલ્લાહમાં થયો હતો. આ વિસ્ફોટમાં ૧૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે, બલુચિસ્તાનમાં આ બોમ્બ વિસ્ફોટો પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી તેમજ ચાર પ્રાંતીય એસેમ્બલીની ચૂંટણી માટે મતદાનના ૨૪ કલાકથી ઓછા સમય પહેલા થયા હતા. ૨૨ મુકત ઉપરાંત અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. આ હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સ્થળ પર સુરક્ષા જવાનો તેનાત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં આવતીકાલે એટલે કે ૮મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલી માટે ચૂંટણી યોજવાની છે. મતદાન સવારે ૮ વાગ્યે (05:00 GMT) ખુલશે અને સાંજે ૫ વાગ્યે (12:00 GMT) બંધ થશે. જો ચૂંટણી પંચ પરવાનગી આપે તો કેટલાક વિસ્તારોમાં મતદાનનો સમય વધારી શકાય છે. આ પહેલા પાકિસ્તાનના ૩૨ ઈસ્માઈલ ખાનમાં પણ હુમલો થયો હતો. અહીં એક પોલીસ સ્ટેશન પર થયેલા આંતકી હુમલામાં ૧૦ પોલીસકર્મીઓના મોત થયા હતા. હુમલો મધ્યરાત્રિ પછી થયો હતો, જ્યારે મોટાભાગના પોલીસકર્મીઓ ઊંઘી રહ્યા હતા. નિદ્રાધીન પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસ કોર્ટ જવાબી કાર્યવાહી કરી શકી ન હતી. તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં વારંવાર આંતકવાદી હુમલાઓ થઈ રહ્યા છે અને પાકિસ્તાનની વચગાળાની સરકાર તેને રોકવામાં નિષ્ફળ રહી છે. હાલમાં જ બલુચિસ્તાનના નુરકી જિલ્લામાં આવી જ એક ઘટના જોવા મળી હતી.

શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈપણ ઋતુમાં પહેલા જે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તેનું હવે નિરાકરણ આવ્યું : લાભાર્થી નરેશભાઈ વાળંદ

સરકાર તરફથી ત્રણ હતામાં રૂપિયા ૧,૨૦,૦૦૦ની સહાય મળી, જેનાથી મે મારા કાયા મકાનને પાકું બનાવ્યું : લાભાર્થી નરેશભાઈ વાળંદ

। (મિતેષ સોલંકી, પ્રાદેશિક માહિતી કચેરી) અમદાવાદ । ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં સમાન્ય નાગરિકો માટે ઉત્તમ લાવવાનું કાર્ય કર્યું છે. આ સાથેજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગરીબ અને વ્યથિત પરિવારના ઘરનાં ધર નિર્માણ થતા અનેક ચહેરાઓ પર ઉમંગ અને હર્ષની લાગણી જોવા મળી છે. ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા શહેરીને ગ્રામ્ય વિસ્તારમાં કાયા મકાનમાં રહેતા અને ઘર વિહોણા પરિવારોને મકાન માટે સહાયનો લાભ આપવામાં આવી રહ્યો છે, એવામાં ધોળકા તાલુકાના રહેવાસી નરેશભાઈ વાળંદ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી બન્યા છે. નરેશભાઈ વાળંદ જણાવે છે કે, છેલ્લા ઘણા વર્ષોથી હું અને મારું પરિવાર કાયા મકાનમાં રહીએ છીએ. ઘરમાં કમાવવાવાળો હું એક જ વ્યક્તિ છું. હાલમાં હું છૂટક મજૂરી કરીને કમાઉં છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, કાયા મકાનમાં દરેક ઋતુમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. ચોમાસામાં પાણી પડવાથી અને શિયાળા તથા ઉનાળામાં સખત ઠંડી અને ગરમીનો સામનો કરવો પડતો હતો. પરંતુ થોડાક સમય પહેલા જ મને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણ થઈ અને મેં પણ એમાં ફોર્મ ભર્યું હતું. જેમાં આ વર્ષે મને સરકાર તરફથી ત્રણ હતામાં રૂપિયા ૧,૨૦,૦૦૦ની સહાય મળી. જેનાથી મે મારા કાયા મકાનને પાકું બનાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે મારું પાકું મકાન બનીને તૈયાર થઈ ગયું છે અને શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈપણ ઋતુમાં પહેલા જે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો તેનું હવે નિરાકરણ આવ્યું છે. અંતે તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પ્રાપ્ત થવાથી મને ઘરનું ધર, મારા સપનાનું ધર પ્રાપ્ત થયું છે જેનાથી મને અને મારા પરિવારને આનંદ અનુભવાય છે. જે બદલ હું કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મારા જેવા અન્ય નાગરિકોને પણ આ યોજનાનો લાભ લેવા માટે જાણ કરું છું.



વિશેષ વરણપાલિકા ટી. વાઘેલા (દરબાર ગઢ, વર)

લગભગ આખો સમાજ આજે આવી ભ્રામકતામાં જ જીવે છે બાકી સૌ કોઈ બાજે છે કે અહીં એકબીજાનો સાથ કર્યાં કાયમનો છે જીવનને સુંદરતાનાં શિખરે લઈ જવા બહારની બદલે ખુદના આંતર વિગ્રહમાં ખોજ કરવી પડશે

હૈ ઈશ્વર. આપના શ્રી આચરણોમાં મારા સહ પરિવાર સાદર સાધાંગ પ્રેમ પ્રણામ. માનવીય માનસિકતા છે, કે પોતે જીવનને સુંદર બનાવવા માટે, અન્ય કેટલાકમાં જીવન રંગદોળી શકે, આવા નાના કારણોસર આપણે જીવન સુંદર બનાવી શકતા નથી, બાકી પરમાત્મા એ જ્યારે માનવ રૂપે જન્મ આપ્યો હતો, ત્યારે જીવન તો ખુબ સુંદર, એકદમ નિર્મળ, અને પવિત્ર ગંગાજળ જેવું જ હતું. વ્યક્તિગત કારણો હોય તો કોઈ એકના જીવન પર અસર પડે, પરંતુ આ તો સમાજનું સર્વજ્ઞ છે. લગભગ આખો સમાજ આજે આવી ભ્રામકતામાં જ જીવે છે. બાકી સૌ કોઈ જાણે છે કે અહીં એકબીજાનો સાથ કર્યાં કાયમનો છે, મારા ભાગનું પ્રારબ્ધ ભોગવીને હું જીંદગી, તેના ભાગનું પ્રારબ્ધ ભોગવીને તે જશે. તો આટલી ઘડી કે આટલો સમય આપણે શું શાંતિથી એકબીજાના જીવનનો અને એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરીને જીવી ન શકીએ!! કહેવામાં સહેલું છે. પરંતુ એકબીજાના અસ્તિત્વને એટલું સહજતાથી સ્વીકારી શકાતો નથી, અહમ, આઝ, દુરાઝ, પૂર્વાઝ, એવી કેટલીય ગ્રંથી વચ્ચે આવે છે, એ બધું આપણા જીવનને સુંદર બનાવવા દેતું નથી, બાકી જીંદગી તો એક પ્રેમને વહાવતું ગીત છે. બસ આ ભાવનો સંદર્ભ લઈને આજે આપણે તરારને કી તર્જ જીવન કા અર્કમાં આગળ ચિંતન કરીશું. ૧૮૭૨ની સાલમાં બનેલી શોર નામની ફિલ્મનું આ ગીત છે, આ ગીતનું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલ એ આપ્યું છે, તેમજ મુકેશ અને લતા મંગેશકરના અવાજમાં ગવાયેલા આ

ગીતના શબ્દો સંતોષ આનંદના છે. પંચતત્વ માંથી બનેલો આ દેહ પંચતત્વ જેટલો જ નિર્મળ છે, અને તેના દ્વારા જીવનને સુંદર અને તત્વની નિર્મળતા બરકરાર રહે તો નિર્મળ અને સુંદર બને છે. કવિએ કોઈવાર સમુદ્રના મોજાં સાથે જીવનને સરખાવ્યું છે, કોઈ વાર નદીયાની ધારા સાથે, તો કોઈ વાર બાદલ સાથે, આ બધા જ પ્રાકૃતિક તત્વોમાં સ્વાર્થની ભાવના ન હોવાથી તે કાયમ નિર્મળ રહી શકે છે. જ્યારે આપણે સ્વાર્થનો તંતુ છોડી શકતા નથી, માટે આપણા જીવન નિર્મળ રહી શકતા નથી, કે જીવન સુંદર બની શકતા નથી, બાકી આ પંચતત્વ આપણા અસ્તિત્વનો પણ આધાર છે. બોલવામાં કેટલું સહેલું અને સારું લાગે કે, પેલાનું હવા જેવું હલકું ફૂલકું જીવન, પાણી જેવું સરળ જીવન, ફૂલો જેવું મહેકતું જીવન, ફળ જેવું મધુર જીવન, સૂર્ય જેવું તેજસ્વી જીવન, પૃથ્વી જેવું અચલ જીવન, આકાશ જેવું વિશાળ જીવન. પણ એવું જીવન બનાવવા માટે શું આપણા થતી યથાર્થ પ્રયત્નો થાય છે બરા! માત્ર વાતો કરવી હોય, કે ભાષણો કરવાનાં હોય, જિંદગી ના સત્ય વિશેની ફિલોસોફી લખવી હોય, તો આ બધું સારું લાગે, અને લખી પણ શકાય! કારણ કે આ યુગની સ્માર્ટનેસ ને કારણે આપણે ખુદના જીવનમાં પણ અભિનય કરતો શીખી ગયા છીએ. આળપંપાળ ના દેખાડા કે બખાળા કાઢવાનું આપણને આવડી ગયું છે, અને સમયે કોઈ કાર્ય કરવામાં ન આવે તો એ પછી કરીશું! માં સમય લંબાતો જાય છે, અને જીવનનો અંત આમ જ આવી જાય છે. સામાજિક રીતે જોઈએ તો ગઈ કાલે વાત કરી હતી, તેમ આટલા વર્ષો પહેલા રાષ્ટ્રપિતા ગાંધીની હત્યા થઈ, અને લગભગ બધા મહાન કહી શકાય એવા માનવીને મૃત્યુ કદાચ આ જ રીતે મળ્યું છે, અને આપણા માંના કોઈ એની માટે નિમિત્ત બન્યાં, એ

બતાવે છે કે આપણી માનસિકતા હજી ત્યાંને ત્યાં જ છે. ફૂવામાંના ટેડકાની જેમ બંધિયાર પાણીમાં આપણા જીવન આગળનું કંઈ સારું જોઈ શકતા નથી, અને રાગ દ્રેષ, મોહ માયા, ઈર્ષાં નિંદા, કે લાલસાનાં ગંધાતા પાણીમાં પડ્યા રહીને જીવન પુરું થઈ જાય છે. ક્યાંક માન્યતાઓનું કારણ, ક્યાંક રીતરિવાજો ના કારણ, ક્યાંક આવાં અજ્ઞાન જ્ઞાન, તો ક્યાંક આધુનિકતા, આ બધા કારણોને કારણે આપણે જીવું જોઈએ એ દિશામાં જીવનની ધારાને લઈ જઈ શકતા નથી, અને એને પરિણામે જીવન સુંદર બની શકતું નથી બાકી અહીં જીવન તો એક પ્રેમનું ગીત છે, અથવા તો પ્રેમ વધારવાનો માર્ગ છે, પ્રેમ નિભાવવાનો માર્ગ છે, કે પછી સૌથી સાચું! સચ્ચિદાનંદ સ્વરૂપ સુધી લઈ જનારું એક અભિન્ન અંગ છે. ઘણીવાર વિચાર આવે કે કવિની કલ્પનાઓ જ આટલી સુંદર હશે! કે પછી કવિને આવો કોઈ અનુભવ પણ થયો હશે, કે પછી માનવોએ આવું જીવન જીવવું જોઈએ એવા સંદેશા રૂપે આવી રચના લખાઈ હોઈ શકે. કવિની કલ્પના પણ રોમાંચક છે, આપણા જીવન પવન જેમ લહેરાઈ શકતા હોય, પાણી જેમ નિર્મળતાથી વહી શકતા હોય, ફૂલ જેમ મહેકતા હોય, તો આ બધું જ કેટલું સુંદર લાગે! કાશ આવુ થાય! ક્યારેક વગર કારણે ઉતાવળા થઈ જઈએ, તો ક્યારેય કારણ વગર વર્ષો સુધી રાહ જોઈએ, કે પ્રારબ્ધની પોટલી ખુલશે, અને એકને એક દિવસ તો બધું સરખું થઈ જશે! એવું વિચારી પુરુષાર્થ કરવાનો સમય પ્રારબ્ધની રાહ જોવામાં ગયો, અને જ્યારે પ્રતીક્ષાનો સમય આવ્યો ત્યારે ખોટો ઉત્પાત કરી અને જીવન ડહોળી નાંખ્યું, એટલે જીવન સુંદર લાગતું નથી, જીવન સરળ લાગતું નથી, જીવનનો થાક લાગે છે, અને ક્યાંક ક્યાંક તો નાની ભૂલોના મોટાં પરિણામ આવતા બોજ પણ લાગે છે.

વિજ્ઞાનની રીતે આપણે કેટલો વિકાસ કર્યો છે, અને આમ જુઓ તો આપણે પહેલા આદિ માનવનું સ્વરૂપ જોઈએ તો આપણે વાનર જ હતાં, એમાંથી વિકસિત થઈને આજે માનવ બન્યાં. એ વાનર પોતાનું જીવન સુંદર બનાવી શક્યાં, પણ આપણે માનવ થયા એટલે જ જીવનને સુંદરતાના શિખર સુધી લઈ જઈ શકતા નથી, એવો સીધો સાદો અર્થ કાઢી શકાય. બીજી રીતે જોઈએ તો અન્ય ગ્રહ પર પણ આપણે પહોંચી શક્યાં, પણ આપણા આગ્રહને છોડી શક્યા નહીં, એટલે જીવન સુંદર બની શકતું નથી. હજી કંઈ મોડું થયું નથી આપણે ધારીએ તો મંગળમાં પણ જીવન શોધી શકીએ તેમ છીએ, એટલું સાહસ અને હિંમત આપણામાં ભર્યા છે, અને એનું કારણ છે કે એ બધી ખોજ આપણે બહાર કરી, અને બહાર તો આપણે બધું જ શોધવા સક્ષમ છીએ, પણ ખુદના આ વિગ્રહમાં જ્યારે આપણે આપણું આત્મતત્વ ખોજી શકીશું, ત્યારે જ આપણા જીવન સુંદર બની શકશે, આ એક નિતાંત સત્ય છે, અને આ સત્યનો જેટલો ઝડપથી સ્વીકાર કરી શકીશું, એટલા આપણે આપણા જીવનમાં પણ પવન જેવા હળવા ફૂલ, ફૂલ જેવા સુગંધિત, નદી જેવી નિર્મળતા આ બધું જ અનુભવાશે. પણ બહારની બદલે ખુદના વિગ્રહમાં ખોજ કરવી પડશે, તો જ જીવન સુંદર બની શકશે, આપણે સૌ આ નિતાંત સત્યનો નિખાલસતાથી પ્રયોગ કરી શકીએ, અને જેટલું ઉલેચી શકાય એટલો અજ્ઞાન કે અહમનો કિચડ બહાર કાઢી, અને અંદર પણ એ જ નિર્મળતા, એ જ દિવ્યતા, અને એસ સચ્ચિદાનંદ સ્વરૂપ ના દર્શન કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીધારામ.

જ્યારે ચહેરાની સુંદરતા માત્ર આંખોમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે પ્રકૃતિની સુંદરતા હૃદય સુધી પહોંચે છે

દુ:ખ એ વાંદરાઓ જેવું છે જે જ્યારે પીઠ ફેરવે છે ત્યારે તેની પાછળ આવે છે અને જ્યારે સામે આવે ત્યારે ભાગી જાય છે

ભગવાન શ્રી કૃષ્ણ એ બહુ પરીમાણીય વ્યક્તિત્વનો ભંડાર છે. એક બાજુ તેઓ વંશીધર છે અને બીજી બાજુ તેઓ ચક્રધાર છે, એક બાજુ તેઓ માખણ ચોર નારા છે અને બીજી બાજુ તેઓ બ્રહ્માંડને ખવડાવનારા છે. એક તરફ તે બનવારી છે અને બીજી બાજુ તે ગિરધારી છે, એક બાજુ તે રાધારમણ છે અને બીજી બાજુ તે રૂકમણીનું અપહરણ કરનાર છે. ક્યારેક શાંતિના દૂત, ક્યારેક ક્રાંતિ ના દૂત, ક્યારેક માતા યશોદાના પુત્ર અને ક્યારેક માતા દેવકીના પુત્ર. ક્યારેક યુદ્ધના મેદાન માંથી ભાગી જવાની ક્રિયા, તો ક્યારેક હજાર માથાવાળા નાગના માથા પર નાચવાનું. નિર્ભયતાથી જીવન જીવવાનું નામ કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણએ જીવનને સંપૂર્ણ રીતે સ્વીકારવાનો પાઠ શીખવ્યો. ઓમ શ્રી કૃષ્ણનું જીવન આપણને પરિસ્થિતિઓથી ભાગવાનું નહીં પરંતુ હિંમતભેર સામનો કરવાનું શીખવે છે. ભગવાન શ્રી કૃષ્ણ મહાન કર્મયોગી હતા, તેમણે અર્જુનને સમજાવ્યું કે હે અર્જુન! સંમત છું કે કામ થોડું દુ:ખદાયક છે પણ કામ કર્યા વિના સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. જો કોઈ ક્રિયાનો હેતુ શુદ્ધ અને શુભ હોય તો તે ક્રિયા સત્કર્મ બની જાય છે. જીવનનો એક સાદો નિયમ છે અને એ છે કે જો શિસ્ત ન હોય તો પ્રગતિ થતી નથી. અનુશાસનમાં વહેવાથી જ નદી સાગર સુધી પહોંચે છે અને મહા સાગર બની જાય છે. શિસ્તબદ્ધ રહેવાથી જ વેલો જમીન પરથી ઊગીને

વૃક્ષની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે અને શિસ્ત બદ્ધ રહેવાથી જ વાયુ ફૂલો ની સુગંધ ગ્રહણ કરીને સુગંધિત બને છે અને ચારેય દિશાઓને સુગંધથી ભરી દે છે. જો પાણી અવ્યવસ્થિત હોય, તો તે પૂરનું સ્વરૂપ લે છે. જો પવન અનુશાસનહીન હોય તો તે તોફાન બની જાય છે અને જો અગ્નિ અનુ શાસનહીન હોય તો તે મહાન વિનાશનું કારણ બને છે. તેવી જ રીતે, અનુશાસનહીનતા ફક્ત પોતાના જીવનનો વિનાશ જ નથી કરતી પણ બીજા માટે પણ વિનાશનું કારણ બને છે. જો ગાડી શિસ્તમાં ચલાવે તો પ્રવાસનો આનંદ વધુ વધે છે. તેવી જ રીતે જો જીવન શિસ્તમાં જીવવામાં આવે તો જીવનની સફરનો આનંદ વધુ વધે છે. જીવનનો ઘોડો નિરંકુશતા કે અનિચ્છિતતાનો ત્યાગ કરીને પ્રગતિના પંથે કે તેના લક્ષ્ય તરફ સતત દોડતો રહે તે માટે શિસ્તના રૂપમાં લગભગ પોતાના હાથમાં હોવી જરૂરી છે. હંમેશા માત્ર સારા વ્યવસાય માટે જ નહીં પણ સારા વર્તન માટે પણ પ્રયત્નશીલ રહો. જ્યારે સારો વ્યવસાય તમને ખુશ રાખશે, તો સારું વર્તન તમને આંતરિક સુખ આપશે. આપણા જીવનમાં ઘણી બધી પરેશાનીઓનું એક જ કારણ છે અને તે છે પ્રકૃતિ. જો કંઈ ન હોય તો અભાવ પીડાય છે. કંઈક થાય તો યાતના અનુભવે છે અને બધું થાય તો કુદરત યાતના આપે છે. ખરાબ સ્વભાવથી આપણે સરળ વસ્તુઓને પણ મુશ્કેલ બનાવી દઈએ છીએ. હૃદયમાં ખોટું વર્તન, ગુસ્સો, અશાંતિ અને ભય પેદા કરે છે. વ્યાપાર તમને બાહ્ય સુખ આપશે પરંતુ માત્ર મધુર વર્તન તમને આંતરિક સુખ, આનંદ અને નિર્ભયતા

આપશે. માત્ર વ્યવસાય વિશે જ નહીં પણ વર્તન વિશે પણ વિચારો. સુંદરતાનો અભાવ પણ સારો સ્વ ભાવ સરભર કરે છે, પરંતુ જો સારા સ્વભાવની ઉણપ હોય તો તેને સુંદરતાથી ક્યારેય પુરી શકાતી નથી. ચહેરાની સુંદરતા પ્રકૃતિ પર નિર્ભર કરે છે પણ પ્રકૃતિની સુંદરતા તમારા વલણ પર આધારિત છે. જ્યારે ચહેરાની સુંદરતા માત્ર આંખોમાં પ્રતિબિંબિત થાય છે, ત્યારે પ્રકૃતિની સુંદરતા હૃદય સુધી પહોંચે છે. માણસ નાખુશ રહે છે કારણ કે તે પોતાનું ઘર, શહેર, દેશમિત્રો, સંબંધો બધું જ બદલી નાખે છે પણ તેનો સ્વભાવ બદલી શકતો નથી. જીવનનું સત્ય એ છે કે માણસ પોતાના સ્વભાવથી સુખી કે દુ:ખી થાય છે. સારો સ્વભાવ વ્યક્તિને કોઈના દિલમાં ઉતારી દે છે અને ખરાબ સ્વભાવ વ્યક્તિને કોઈના દિલમાં થી પણ ખસી જાય છે. તેથી, તમારા સ્વભાવને નરમ બનાવો જેથી તમારું સમગ્ર જીવન મધુરતાથી ભરાઈ જાય. જેનો સ્વ ભાવ મધુર હોય છે તેનું જીવન પણ મધુર બને છે. ઘણીવાર લોકો પ્રયત્નો ન કરવાને સંતોષ માને છે. સંતોષ એ નિષ્ક્રિય તાનું નામ નથી, પરંતુ સતત પ્રયત્નો કરીને પરિણામથી અસંબદ્ધ રહેવું એનું નામ સંતોષ છે. સંતોષનો અર્થ એ નથી કે પ્રયાસ ન કરવો પણ પ્રયાસ કર્યા પછી જે મળે તેનાથી ખુશ રહેવું. ઘણા લોકો સંતોષની આડમાં પોતાની નિષ્ક્રિયતાને છુપાવે છે. પ્રયાસ કરવામાં, ઉપક્રમમાં, પ્રયાસ કરવામાં અસંતુષ્ટ રહો. પ્રયત્નોની અંતિમ સીમા પર જાઓ. ધ્યેયને એક ભ્રમ માટે પણ ભૂલશો નહીં. સંતુષ્ટ બનો પણ ક્યારેય આગસુ ન બનો. કોઈપણ કામ કરતી વખતે એ ભાવનાથી કરો કે બધું મારા પર નિર્ભર

છે. કાર્ય કર્યા પછી, બધું ભગવાન પર નિર્ભર છે તેવી લાગણી સાથે તમારી જાતને સમર્પિત કરો. પરિણામે જે પણ મળે તેને પ્રેમથી સ્વીકારો, આ જ જીવનમાં શાંતિ અને સુખનો માર્ગ છે. સમસ્યા ગમે તેટલી મોટી કેમ ન હોય, તેનો કોઈને કોઈ ઉકેલ ચોક્કસ જ હોય છે. આપણે મક્કમાત્રી સમસ્યાનો સામનો કરવો જોઈએ કારણ કે સમસ્યા નો સામનો કરવાથી દૂર થાય છે, પીછેહઠ કરવાથી નહીં. ભાગવું એ સમસ્યાનો ઉકેલ નથી, જાગવું એ ઉકેલ છે. આ સ્વભાવનો એક નિયમ પણ છે કે અહીં હંમેશા નબળા લોકો જ એકબીજાને ત્રાસ આપે છે અને મજબૂત લોકો તેમની સાથે ખોટું કર્યા પછી પણ પાછળ રહી જાય છે. જો તમારી આત્મશક્તિ નબળી હશે તો જીવન તમને દરેક રીતે ત્રાસ આપશે. દુ:ખ સાથે પણ એવું જ થાય છે. તમે દુ:ખથી દૂર ભાગવાનો જેટલો પ્રયત્ન કરશો, તેટલા વધુ દુ:ખ તમારા પર હાવી થશે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે દુ:ખ એ વાંદરાઓ જેવું છે જે જ્યારે પીઠ ફેરવે છે ત્યારે તેની પાછળ આવે છે અને જ્યારે સામે આવે ત્યારે ભાગી જાય છે. સમસ્યાને ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે સમસ્યાનો મજબૂતાઈથી સામનો કરવો. વાયક ચાલક મિત્રો, આપણે ભગવદ્ ગીતા જ્ઞાનમાં સતત ચિંતન મનન પછી જીવન ઉત્તમ રસ્તે કેવી રીતે જીવી શકાય તે જાણવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે આજે પોષી ચૌદસ અમાસ સાથેનો સંયોગ છે. આપ સૌને આ લેખમાળાના મણકા ચોક્કસ આનંદ આપતા હશે તેવી આશા સહ અસ્તુ.

રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સભ્યોની વિદાય વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

આ ગૃહમાં દર બે વર્ષ પછી આ પ્રકારની ઘટના બને છે, પરંતુ આ ગૃહ સાતત્યનું પ્રતિક છે. ૫ વર્ષ પછી લોકસભાને નવા રૂપમાં શણગારવામાં આવ્યું છે. આ ઘરને દર ૨ વર્ષ પછી એક નવી પ્રાણશક્તિ મળે છે, એક નવી ઉર્જા મળે છે, વાતાવરણને નવા જોશ અને ઉત્સાહથી ભરી દે છે. અને તેથી દર બે વર્ષે જે વિદાય થાય છે તે કોઈપણ રીતે વિદાય નથી. તેઓ અહીં આવી યાદો પાછળ છોડી જાય છે, જે આવનારા નવા બેચ માટે અમૂલ્ય વારસો છે. અહીંના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ જે વારસાને વધુ મૂલ્યવાન બનાવવાનો પ્રયાસ કરે છે. આદરણીય સાંસદો, કેટલાક લોકો જઈ રહ્યા છે, કદાચ કેટલાક લોકો આવવા માટે જ જઈ રહ્યા છે, અને કેટલાક લોકો જવાના છે. હું ખાસ કરીને માનનીય ડૉ. મનમોહન સિંહ જીને યાદ કરવા માંગુ છું. તેમણે આ ગૃહમાં પોતાના મૂલ્યવાન વિચારોથી અને એક નેતા તરીકે તેમજ વિપક્ષમાં પણ દ વખત મોટું યોગદાન આપ્યું છે. વૈચારિક મતભેદો, કેટલીકવાર વાદ-વિવાદમાં ઉચ્ચપાથલ થાય છે, તે ખૂબ જ અલ્પ જીવી હોય છે. પરંતુ તેમણે આટલા લાંબા સમય સુધી આ

ગૃહ અને દેશને જે રીતે માર્ગદર્શન આપ્યું છે, જ્યારે પણ આપણી લોકશાહીની ચર્ચા થશે, ત્યારે કેટલાક માનનીય સભ્યોની ચર્ચામાં માનનીય ડૉ. મનમોહન સિંહનો ઉલ્લેખ થશે. યોગદાનની ચર્ચા ચોક્કસપણે થશે. અને હું ચોક્કસ પણ તેમના સાંસદોને કહીશ, પછી ભલે આ ગૃહમાં હોય કે તે ગૃહમાં, જેઓ આજે હાજર છે અથવા જેઓ ભવિષ્યમાં આવી શકે છે, પછી ભલે આ માનનીય સાંસદો કોઈપણ પક્ષના હોય. પરંતુ જે રીતે તેમણે પોતાનું જીવન ચલાવ્યું છે. માર્ગદર્શક પ્રકાશ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જે પ્રતિભા દર્શાવી હતી તેમાંથી આપણે શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. મને યાદ છે, તે ગૃહની અંદર છેલ્લા થોડા દિવસોમાં મતદાનની તક હતી, હું વિષય ચૂકી ગયો હતો, પરંતુ હું જાણતો હતો કે વિજય ટ્રેઝરી બેંકનો થવાનો છે, તકાવત પણ મોટો હતો. પરંતુ ડૉ. મનમોહન સિંહ હે ઓલિવરમાં આવ્યા, મતદાન કર્યું, તેઓ એક હિંદુ હાજર હતા કે એક સાંસદ તેમની જવાબદારીઓ પ્રત્યે કેટલા જાગૃત છે, તેઓ એક પ્રેરણાદાયી ઉદાહરણ હતા. આટલું જ નહીં, મેં જોયું કે કેટલીકવાર જ્યારે

કમિટીની ચૂંટણીઓ થતી ત્યારે કમિટીના સભ્યો ઓલિવર પર મતદાન કરવા આવતા. સવાલ એ નથી કે તેઓ કોને સત્તા આપવા આવ્યા હતા, હું માનું છું કે તેઓ લોકશાહીને સત્તા આપવા આવ્યા હતા. અને તેથી આજે ખાસ કરીને હું તેમના લાંબા આયુષ્ય માટે આપણા બધા વતી પ્રાર્થના કરું છું, તેઓ આપણને માર્ગદર્શન આપતા રહે અને પ્રેરણા આપતા રહે. આદરણીય અધ્યક્ષ, અમારા મિત્રો જે નવી જવાબદારીઓ તરફ આગળ વધી રહ્યા છે, આ મર્યાદિત વિસ્તરણમાંથી મોટા વિસ્તરણ તરફ આગળ વધી રહ્યા છે, રાજ્યસભામાંથી જનસભા તરફ આગળ વધી રહ્યા છે. તેથી હું માનું છું કે તેઓ આટલા મોટા મંચ પર જઈ રહ્યા છે ત્યારે અહીં તેમનો સહયોગ અને અનુભવ દેશ માટે મોટી સંપત્તિ સાબિત થશે. યુનિવર્સિટીમાં પણ ૩-૪ વર્ષ પછી એક નવું વ્યક્તિત્વ ઉભરી આવે છે, આ દ વર્ષથી વિવિધતાથી ભરેલી યુનિવર્સિટી છે. આ અનુભવથી ઘડાયેલી યુનિવર્સિટી છે, જ્યાં દ વર્ષ પછી એક કોઈપણ વ્યક્તિ આવી તેજસ્વીતા સાથે બહાર આવે છે. વ્યક્તિત્વ.

હા, તે આવા તેજસ્વી સ્વરૂપમાં જાય છે, તે જ્યાં પણ રહે છે, ગમે તે ભૂમિકા ભજવે છે, તે ચોક્કસપણે આપણા કાર્યને વધુ શક્તિશાળી બનાવશે અને રાષ્ટ્રના કાર્યને ઝડપી બનાવવાની શક્તિ આપશે. આ માનનીય સાંસદો જે જઈ રહ્યા છે, એક રીતે એવું જૂથ છે કે જેમને બંને ગૃહોમાં, જૂની સંસદ ભવન અને નવી સંસદ ભવન બંનેમાં રહેવાની તક મળી. જો આ મિત્રો વિદાય લઈ રહ્યા છે, તો તેઓ આઝાદીના ૭૫ વર્ષ અને આપણા બંધારણના ૭૫ વર્ષના નેતૃત્વના સાક્ષી બનીને વિદાય લઈ રહ્યા છે, જે તેઓ છોડી રહ્યા છે, તેમાં ગૌરવ ઉમેરી રહ્યા છે, તેઓ આજે બધા માટે વિદાય લઈ રહ્યા છે, તેથી ઘણા લોકો યાદો સાથે વિદાય લઈ રહ્યા છે. આપણે એ દિવસને ભૂલી શકતા નથી જ્યારે કોવિડના મુશ્કેલ સમયમાં આપણે બધાએ સંજોગોને સમજ્યા હતા અને સંજોગો પ્રમાણે પોતાને ઘડ્યા હતા. જો તમને અહીં બેસવાનું કહેવામાં આવે તો તમે અહીં બેસો, જો તમને ત્યાં બેસવાનું કહેવામાં આવે તો તમે ત્યાં બેસો, જો તમને તે રૂમમાં બેસવાનું કહેવામાં આવે તો, કોઈપણ પક્ષના કોઈ સાંસદે આવા પર દેશનું કામ અટકાવવા દીધું નથી.

કોરોનાનો તે સમયગાળો જીવન અને મૃત્યુનો ખેલ હતો. જો તમે ઘર છોડશો તો શું થશે તે ખબર નથી. તે પછી પણ માનનીય સાંસદો ગૃહમાં આવ્યા અને દેશ પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવી. દેશને આગળ લઈ ગયો. અને તેથી મને લાગે છે કે તે સમયગાળાએ આપણને ઘણું શીખવ્યું છે. કોટકટી વચ્ચે પણ ભારતની સંસદમાં બેઠેલા લોકો પ

મલ્ટિટાસ્કિંગ મગજને તમારા ફોકસને એક કાર્યમાંથી બીજા કાર્યમાં ખૂબ જ ઝડપથી ફેરવવા દબાણ કરે છે  
**ફોકસ: તે શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે**



**ફોકસ:** કેવી રીતે ફોકસ અને એકાગ્રતામાં સુધારો કરવો તેની અંતિમ માર્ગદર્શિકા પ્રથમ વસ્તુઓ પ્રથમ. ધ્યાન શું છે, ખરેખર? નિષ્ણાતો ધ્યાનને તમારી રુચિ અથવા પ્રવૃત્તિને કંઈક પર કેન્દ્રિત કરવાના કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે કંઈક અંશે કંટાળાજનક વ્યાખ્યા છે, પરંતુ તે વ્યાખ્યાની અંદર એક મહત્વપૂર્ણ આંતરદષ્ટિ છુપાયેલી છે. ફોકસ શું છે? એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, તમારે મૂળભૂત રીતે, અન્ય ઘણી બાબતોને અવગણવી જોઈએ. તેને મૂકવાની અહીં વધુ સારી રીત છે: ફોકસ ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણે એક વિકલ્પ માટે હા અને બીજા બધા વિકલ્પો માટે ના કહી હોય. બીજા શબ્દોમાં કહીએ તો, ધ્યાન કેન્દ્રિત કરવા માટે દૂર કરવું એ પૂર્વશરત છે. જેમ ટિમ ફેરિસ કહે છે, “તમે શું નથી કરતા તે નક્કી કરે છે કે તમે શું કરી શકો.” અલબત્ત, ફોકસ માટે કાયમી નંબરની જરૂર નથી, પરંતુ તેને હાજર નંબરની જરૂર છે. તમારી પાસે હંમેશા પછીથી કંઈક બીજું કરવાનો વિકલ્પ હોય છે, પરંતુ વર્તમાન ક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે કે તમે માત્ર એક જ કાર્ય કરો. ફોકસ એ ઉત્પાદકતાની ચાવી છે કારણ કે દરેક અન્ય વિકલ્પને ના કહેવાથી બાકી રહેલી એક વસ્તુને પૂર્ણ કરવાની તમારી ક્ષમતા ખુલી જાય છે. હવે મહત્વના પ્રશ્ન માટે: જે બાબતો મહત્વની હોય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ન હોય તેવી બાબતોને અવગણવા આપણે શું કરી શકીએ? મોટાભાગના લોકોને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડતી નથી. તેમને નિર્ણય લેવામાં તકલીફ પડે છે. મારો કહેવાનો મતલબ એ છે કે મોટા ભાગના સ્વસ્થ માણસો પાસે મગજ હોય છે જે ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ હોય છે જે આપણે વિશ્લેષણને દૂર કરીએ. શું તમે ક્યારેય એવું કાર્ય કર્યું છે જે તમારે પૂર્ણ કરવાનું હતું? શું થયું? તમે તે કરી લીધું કારણ કે અંતિમ તારીખે તમારા માટે નિર્ણય લીધો હતો. કદાચ તમે અગાઉથી વિલંબ કર્યો, પરંતુ એકવાર વસ્તુઓ તાકીદની બની ગઈ અને તમને નિર્ણય લેવાની ફરજ પડી, તમે પગલાં લીધાં. ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક વસ્તુ પસંદ કરવાનું મુશ્કેલ કાર્ય કરવાને બદલે, અમે ઘણીવાર પોતાને ખાતરી આપીએ છીએ કે મલ્ટિટાસ્કિંગ એ વધુ સારો વિકલ્પ છે. આ બિનઅસરકારક છે. ધ્યાન અને એકાગ્રતામાં નિપુણતા મેળવવી મુશ્કેલ બની શકે છે. ચોક્કસ, મોટાભાગના લોકો ધ્યાન કેવી રીતે વધારવું અને એકાગ્રતા કેવી રીતે વધારવી તે શીખવા માગે છે.

**તમારે પણ કલાકો સુધી ટોચલેટમાં બેસવા છતાં પેટ સાફ નથી થવું? મોંઘી દવાઓ નહીં ૧૦ રૂપિયાની વસ્તુ ગાયબ કરી દેશે કબજિયાત**

સ્વાસ્થ્ય જાળવવા માટે, ઘણી વસ્તુઓનું સામાન્ય રીતે યોગ્ય રીતે કામ કરી શકતું નથી, ત્યારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થવા લાગે છે. પરંતુ આજકાલ લોકો તેમના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખી શકતા નથી, સમયસર ડાયેટ નથી લઈ શકતા અને જો શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થવા લાગે છે તો તેઓ શરૂઆતમાં તેની અવગણના કરી દે છે. કબજિયાત આનું સૌથી મોટું ઉદાહરણ છે, જેને ઘણીવાર શરૂઆતમાં અવગણવામાં આવે છે અને પછીથી તે ગંભીર સમસ્યા બનીને આપણી સામે આવીને ઊભી રહે છે. જ્યારે કબજિયાત ગંભીર બની જાય છે, ત્યારે લોકો તેમના પેટને સાફ કરવા માટે દરરોજ દવાઓ લેવાનું શરૂ કરે છે. જ્યાં સુધી તમે દવાઓ લેતા હોવ ત્યાં સુધી આ દવાઓ કામ કરે છે. દવાઓ લેવાનું બંધ કર્યાના થોડા સમય પછી ફરીથી કબજિયાત શરૂ થાય છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર છે જેની મદદથી કબજિયાત દૂર કરી શકાય છે અને અમે તમને આમાંથી એક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ કબજિયાતથી પરેશાન છો તો તમે પણ મોંઘી દવાઓ બાઈને કંટાળી ગયા હશો. પરંતુ માત્ર ૧૦ રૂપિયામાં મળતું ઈસબગુલ તમારી કબજિયાતની સમસ્યાને દૂર કરી શકે છે. ઈસબગુલ માત્ર થોડા સમય માટે કબજિયાત મટાડે છે, પરંતુ જો તેનું યોગ્ય રીતે અને યોગ્ય સમય સુધી સેવન કરવામાં આવે તો તે લાંબા સમય સુધી કબજિયાતને દૂર કરી શકે છે. જો તમે કબજિયાતથી સંપૂર્ણ રીતે છુટકારો મેળવવા માંગો છો, તો તમારે ઈસબગુલનું સેવન કરવાની સાચી રીત પણ જાણવાની જરૂર છે. ખરેખર કબજિયાતથી છુટકારો મેળવવા માટે, ઈસબગુલને દહીં સાથે લેવામાં આવે છે, જે પેટમાં જઈને તમારું પાચન સુધારે છે અને આંતરડા સાફ કરવામાં



પણ મદદ કરે છે. પરંતુ કેટલાક લોકોને દહીંને કારણે કબજિયાત પણ થઈ શકે છે, તેથી તેઓ તેને હુંફળા પાણી સાથે પણ સેવન કરી શકે છે. આ બધા સિવાય ઈસબગુલને મોસંબી કે સંતરાના રસમાં ભેળવીને પણ પી શકાય છે. કબજિયાત માત્ર આપણી ખરાબ લાઈફસ્ટાઈલના કારણે જ નહીં પરંતુ તે કેટલાક ગંભીર આંતરિક રોગની નિશાની પણ હોઈ શકે છે. તેથી, જો તમને ગંભીર કબજિયાત હોય અને વારંવાર દવાઓ લેવાથી અથવા ઘરેલું ઉપચાર અપનાવ્યા પછી પણ તમે ફક્ત એક જ વાર તમારું પેટ સાફ કરી શકો છો, તો તે કોઈ ગંભીર આંતરિક રોગની નિશાની હોઈ શકે છે જેને અવગણવી જોઈએ નહીં. તેથી જો લોકો લાંબા સમયથી કબજિયાતથી પીડાતા હોય તેઓએ એકવાર ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ, જેથી કોઈ આંતરિક રોગ હોય તો તે જાણી શકાય. ડોક્ટર પહેલા આંતરિક કારણ શોધી કાઢશે અને પછી તે સુજબ દવાઓ આપવાનું શરૂ કરશે. જ્યારે આંતરિક સમસ્યા દૂર થવા લાગે છે, ત્યારે કબજિયાતમાં પણ આપોઆપ રાહત થવા લાગે છે.

**વિદ્યાર્થીઓના પરીક્ષા સમયે તણાવમાંથી મુક્તિ પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ જેવા મળે છે, ઘણીવાર સ્ટ્રેસને લીધે વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરી લે છે**



પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓના તણાવને દૂર કરવા માટે પ્રશાસન, પોલીસ વિભાગ, સામાજિક સંસ્થાઓ દ્વારા પણ અનેક પ્રકારના કાર્યક્રમો જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જેથી જો બાળક તણાવમાં આવી જાય, તો તે કાઉન્સેલર દ્વારા પોતાનો તણાવ દૂર કરી શકે. પોલીસ વિભાગ દ્વારા સ્ટુડન્ટ હેલ્પલાઈન પણ ચલાવવામાં આવી છે. જો વિદ્યાર્થી તણાવમાં હોય, તો પોલીસ પણ સ્ટુડન્ટ હેલ્પલાઈનનો સંપર્ક કરીને તેમનો સ્ટ્રેસ ઘણા હદ સુધી ઘટાડી શકે છે. વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, છાત્રાલયના વોર્ડન, વાલીઓ સાથે દરરોજ વાત કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ શારીરિક કસરત અવશ્ય કરવી જોઈએ. ૧૦થી ૧૫ મિનિટનો સમય કાઢીને કસરત કરવી જોઈએ. આ ઉપરાંત, આઉટડોર ગેમ રમવી જોઈએ, પાર્કમાં રનિંગ કરવી જોઈએ. વિદ્યાર્થીએ પોતાનું દૈનિક કાર્ય દરરોજ પૂર્ણ કરવું જોઈએ. તેઓએ દરરોજ નવું શીખવું છે, તેનું પુનરાવર્તન કરવું જોઈએ, કાલ માટે કોઈપણ વસ્તુ ઊંડી દેવી જોઈએ નહીં. વિદ્યાર્થીઓએ પુષ્કળ ઊંઘ લેવી જોઈએ, દરરોજ ઓછામાં ઓછી ૬ થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ. ૪ કલાકની ઊંઘમાં શરીર સ્વસ્થ રહેતું નથી. વિદ્યાર્થીઓએ દરરોજ પોષણયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ, લીલા શાકભાજી ખાવા જોઈએ, ફળો ખાવા જોઈએ, જ્યુસ પીવો જોઈએ. વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વની બાબત એ છે કે, તેઓએ પ્રેમસંબંધથી બચવું જોઈએ. પ્રેમસંબંધ માટે તેમની ઉંમર હજી નાની છે, અત્યારે અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો તમે ઈચ્છતા હોવ કે, બાળક પરીક્ષામાં સારા માર્ક્સ લાવે તો, ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવી રાખો. જો તમારા બાળકને કોઈ સવાલ સમજાતો ન હોય તો, તેને સમજાવો. આ બધાંના કારણે બાળકના મગજ પર સકારાત્મક અસર થશે. ઘણાં રિસર્ચમાં આ વાત જાણવા મળી છે કે, પરીક્ષામાં પેરેન્ટ્સનો સપોર્ટ મળતાં બાળક ભણવા પર વધારે મન ફોકસ કરી શકે છે.

**સ્કિન મસ્ત ગ્લો કરશે અને સાથે ખીલ તેમજ કાળા ડાઘા ઘબ્બા પણ દૂર થશે**

સ્કિનની કેર યોગ્ય રીતે કરવી ખૂબ જરૂરી છે. આમ, દરેક લોકો ઈચ્છતા હોય છે કે ફેસ પર મસ્ત ગ્લો આવે અને ચહેરો ચમકીલો બને. ચહેરાને ચમકીલો બનાવવા માટે આ ફેસ પેક બેસ્ટ છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો. સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. સ્કિનની કાળજી તમે પ્રોપર રીતે રાખતા નથી તો સ્કિન ડલ પડવા લાગે છે અને ચહેરો ગંદો લાગે છે. ચહેરા પર ગ્લો લાવવા માટે લોકો જાતજાતની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ પ્રોડક્ટ્સથી લાંબા ગાળે સાર્થક ઈફેક્ટ થઈ શકે છે. પરંતુ તમે સ્કિન પરની ગંદકી દૂર કરવા માટે ફેસ પેક લગાવો છો તો સ્કિન મસ્ત થઈ

જાય છે. તો આજે અમે તમને આ ઘરેલુ ફેસ પેક વિશે જણાવીશું જે તમે ફેસ પર લગાવશો તો સ્કિન મસ્ત ગ્લો કરશે અને સાથે ખીલ તેમજ કાળા ડાઘા ઘબ્બા દૂર થઈ જશે. તો જાણો કેવી રીતે આ ફેસ પેક બનાવશો. આ ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ ત્રણ ચમચી એલોવેરા જેલ, બે ચમચી યજ્ઞાનો લોટ, એક ચમચી મસૂરની દાળ, અડધી ચમચી હળદર. આ બધી વસ્તુ એક બાઉલમાં લઈ લો અને મિક્સ કરો. ત્યારબાદ ત્રણ ચમચી કાજુ દૂધ નાખીને મિક્સ કરી લો. હવે પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને બરાબર એક મિનિટ માટે મિક્સ કરો. ત્યારબાદ ચહેરાને પાણીથી ધોઈ લો.

**BOLLYWOOD NEWS FLASH**

**પહેલી ફિલ્મના ૫૧ રૂપિયા મળ્યા હતા**

સિનેમાની દુનિયામાં સ્ટારડમ અને ફેમ મેળવવા માટે લાખો યુવાનો તેમની કિસ્મત અજમાવે છે અને તેમાંથી માત્ર ૧૦૦ જ સ્ટાર બની શકે છે. સુપરસ્ટારડમ માટે વર્ષોનું સમર્પણ, તમારી જાતને સાબિત કરવાની ભૂખ અને અનેક અડચણોનો સામનો કરવા છતાં આગળ વધતા રહેવાની ધીરજની જરૂર પડે છે. જે આ પરીક્ષા પાસ કરે છે તે ભવિષ્યમાં મોટી સફળતા હાંસલ કરી શકે છે, પરંતુ તે હંમેશા એવું જ રહે તે જરૂરી નથી. જો કે આજે આપણે એક એવા એક્ટર વિશે વાત કરીશું જે હીરો બનવાની આશા સાથે બોમ્બે આવ્યો હતો. તેની ગુડ લુકિંગ પર્સનાલિટી, ઓન-સ્ક્રીન વ્યક્તિત્વ અને અભિનય પ્રતિભાએ તેમને ૭૦-૮૦ના દાયકાના સૌથી મોટા એક્શન સ્ટાર્સમાંના એક બનાવ્યા અને તેઓ સલમાન ખાન સહિત ઘણી પેઢીઓ માટે પ્રેરણા બની ગયા. તેને તેની પહેલી ફિલ્મના માત્ર ૫૧ રૂપિયા મળ્યા અને આજે તે ૪૫૦ કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. ખરેખર, અમે અહીં ધર્મેન્દ્ર વિશે વાત કરી રહ્યા છીએ જેમણે બોલિવૂડના હી-મેનનો ખિતાબ હાંસલ કર્યો છે અને આ સ્ટારડમ જાળવી રાખવામાં તેમને ઘણા વર્ષો લાગ્યા. પંજાબના સાહેબવાલનો આ છોકરો દિલીપ કુમાર અને મોતીલાલની ફિલ્મો જોઈને મોટો થયો હતો. તેમના પિતા સ્કૂલના હેડ માસ્ટર હોવા છતાં, ધર્મેન્દ્રને અભ્યાસમાં રસ ન હતો અને અભ્યાસમાં ખૂબ મહેનત કરે તેવા બાળક નહતાં.

**કંગના રનોતે જુલ્યા છે ચાર નેશનલ એવોર્ડ**

**૧૫ વર્ષની ઉંમરે ઘરેથી ભાગીને બનેલી હિરોઈને સહન કર્યા ઘણા હુકમ**


ઘણા સ્ટાર્સ એક્ટર બનવા માટે પોતાનું બધું દાવ પર મૂકી દે છે. કેટલાક તેમની કિંમતી ચીજ વસ્તુઓ વેચી દે છે, તો કેટલાકને તેમના પરિવારને છોડવું પડે છે. ઘણા લોકો તો ફિલ્મી કરિયર બનાવવા માટે પોતાનો અભ્યાસ પણ અધવચ્ચે જ છોડી દે છે. ઘણા સ્ટ્રગલિંગ કલાકારો તેમના સપના સાકાર કરવા માટે પોતાનું ઘર છોડીને સપનાના શહેર મુંબઈ આવે છે. યશ, શહેનાઝ ગિલ, સોનુ સૂદ અને અન્ય ઘણા કલાકારો છે, જેઓ એક્ટર બનવા માટે ઘરેથી ભાગી ગયા હતા અને આજે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોપના સ્થાને છે. આ યાદીમાં પણ એક એવી અભિનેત્રીનું નામ સામેલ છે જેણે ૧૫ વર્ષની વયે

ફિલ્મો માટે ઘર છોડી દીધું હતું અને આજે તેનું નામ બોલિવૂડની ટોપની અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. અહીં અમે કંગના રનોતેની વાત કરી રહ્યા છીએ, જેણે ટોચનું સ્થાન મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને તેના અભિનય માટે ઘણાં રાષ્ટ્રીય પુરસ્કારો પણ જીત્યા છે. કંગના રનોતે માત્ર ૧૫ વર્ષની ઉંમરે અભિનેત્રી બનવાના સપનાને આગળ વધારવાનું નક્કી કર્યું અને મુંબઈ જવા માટે પોતાનું ઘર છોડી દીધું હતું. જોકે, તેના પિતાએ તેને મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ અભિનેત્રીએ ક્યારેય હાર ન માની. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, જ્યારે તે મુંબઈ આવી ત્યારે તેની પાસે રહેવા માટે ઘર ન હતું અને તેને ફૂટપાથ પર સૂવું પડ્યું હતું. આ સાથે એવું પણ કહ્યું હતું કે, ‘મારી સફર હજારો માઈલની થઈ ગઈ છે. મું મુંબઈમાં ફર્સ્ટ ક્લાસમાં યાત્રા નથી કરી.



**ઇશા-ભરત તપ્પાની પહેલાં ઘણા સ્ટાર્સે લીધા ડિવોર્સ**

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી ઈશા દેઓલ ખબરો મળી રહી છે. ઈશા દેઓલ અને ભરત તપ્પાનીના લગ્ન ૧૨ વર્ષ સુધી ચાલ્યા અને એને બે દીકરીઓ છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આ પહેલો કેસ સામે આવ્યો નથી જેમાં સ્ટાર્સના ડિવોર્સ થયા. આ વિસ્ત્રમાં અનેક સ્ટાર્સ છે જેમના લગ્નના અનેક વર્ષ પછી ડાઈવોર્સ થયા છે. ઈશા દેઓલ અને ભરત તપ્પાનીએ અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. બન્નેએ એક સ્ટેટમેન્ટ જારી કરીને સેપરેશનની જાહેરાત આપી છે. ઈશા દેઓલ અને ભરત તપ્પાનીના આ ન્યૂઝની ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. આ વિસ્ત્રમાં સોહેલ ખાન અને સીમા ખાનનો પણ સમાવેશ થાય છે. આ બન્નેએ વર્ષ ૧૯૯૮માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૨૨માં તલાક લીધા. બન્નેએ લગ્નના ૨૪ વર્ષ પછી તલાક લીધા. સોહેલ ખાને સીમા ખાનના બે દિકરા છે. ફરહાન અખ્તર અને અધુનાએ વર્ષ ૨૦૦૧માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૧૭માં ડાઈવોર્સ થયા. ફરહાન અખ્તર અને અધુનાને બે દીકરીઓ છે. ફરહાન અખ્તરે શિવાની દાંડેકર સાથે બીજા લગ્ન કર્યા.



**ડાયરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ફટેહ ફોડ પર આધારિત હશે**

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ડીપફેક ટૂલ્સ લોકોની પર્સનલ સ્પેસને નુકસાન પહોંચાડવા લાગ્યા છે. બોલિવૂડની ઘણી એવી હસ્તીઓ છે જે આનો શિકાર બની છે. તાજેતરમાં સોનુ સૂદ પણ આનો શિકાર બન્યો હતો. પરંતુ આનાથી પરેશાન થવાને બદલે તેણે તેની સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સોનુ સૂદે કહ્યું હતું કે આ ખૂબ જ ચોંકાવનારું છે. આ બાબત લોકોના ધ્યાન પર લાવવી જરૂરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન સોનુ સૂદે કહ્યું કે, ‘બધા લોકો ડિપફેકની જાણમાં ફસાઈ રહ્યા છે અને તેનો શિકાર બની રહ્યા છે. ઘણા એવા સેલેબ્સ છે જેઓ તેનાથી પીડિત છે. આ એક મોટી ચિંતા છે જેના વિશે વાત થવી જોઈએ. દેશમાં આને લગતી ૨૦૦ હેઠ્ઠી નોંધાર્થી છે. સોનુ સૂદ પણ ડીપફેક વીડિયોનો શિકાર બન્યો છે. જ્યારે તેનો વીડિયો વાયરલ થયો ત્યારે તેના ચહેરા સાથે છોડાડ કરવામાં આવી હતી. વાસ્તવમાં વીડિયોમાં અભિનેતાના નામ પર કોઈ અન્ય વ્યક્તિ ચોરી કરતી જોવા મળી હતી. જેનો ચહેરો તેના ચહેરા સાથે મોર્ક કરવામાં આવ્યો હતો. હવે સોનુ આને રોકવા માટે પગલાં લઈ રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે તે તેની આગામી ફિલ્મ ફટેહથી ડિજિટલ તરીકેની શરૂઆત કરવા જઈ રહ્યો છે.



**બોબી દેઓલની હમરાઝ મૂવીનો બીજો ભાગ આવાની તૈયારી**

એનિમલ્સે વિશ્વભરના બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી હતી. આ ચિત્રને માત્ર થિયેટરોમાં જ નહીં પરંતુ હવે તે પર પણ ધૂમ મચાવી છે. અભરારની ભૂમિકામાં બોબી દેઓલને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આનું કારણ એ શૈલી છે, જેને જોવા ચાહકોની આંખો વર્ષોથી તડપતી હતી. એનિમલ્સથી, દરેક તેની આગામી પિક્ચરની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તે રણબીર કપૂરની ‘રામાયણ’માં કુંભકરણનો રોલ કરવા જઈ રહ્યો છે. પરંતુ આનું ન થયું. હવે એ વાત સામે આવી છે કે ૨૨ વર્ષ પહેલા રિલીઝ થયેલી બોબી દેઓલની ફિલ્મની સિક્વલ બનાવવા જઈ રહી છે. તે ૨૦૦૨માં રિલીઝ થયેલી બોબી દેઓલ, અક્ષય ખન્ના અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ ‘હમરાઝ’ વિશે છે. અબ્બાસ મસ્તાને તેનું ડિઝેઈર્શન કર્યું હતું. દર્શકોને પિક્ચરની સ્ટોરી ખૂબ જ પસંદ આવી હતી. આવામાં ઘણા વર્ષો પહેલા તેની સિક્વલના સમાચાર આવવા લાગ્યા હતા. જે બાદ અબ્બાસ મસ્તાને તેની ચર્ચા કરી હતી અને હવે એ વાત સામે આવી છે કે સિક્વલની કહાની લોક થઈ ગઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અબ્બાસ મસ્તાન અને રતન જૈન ‘હમરાઝ’ની સિક્વલની તૈયારી કરી રહ્યા છે.



# શ્રીલંકાના ડેલિગેટ્સ અમદાવાદ જિલ્લાની મુલાકાતે શ્રીલંકાના જનતા વિમુક્તિ પેરામુના નેતા અને સાંસદ શ્રી અનુરા કુમારા દિસનાયકાની અધ્યક્ષતામાં અન્ય સભ્યઓએ અમદાવાદ જિલ્લાની મુલાકાત લીધી

શ્રીલંકાના ડેલિગેટ્સ આજે અમદાવાદ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ અમદાવાદના સાણંદના ટાટા મોટર્સ પ્લાન્ટ અને આઈ-ક્રીએટ સેન્ટર તથા બાવળાના ઈ-રેડિએશન સેન્ટરની મુલાકાત લીધી હતી.



શ્રીલંકાના જનતા વિમુક્તિ પેરામુના નેતા અને સાંસદ શ્રી અનુરા કુમારા દિસનાયકાની અધ્યક્ષતામાં અન્ય સભ્યઓએ અમદાવાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓએ અમદાવાદના સાણંદના ટાટા મોટર્સ પ્લાન્ટ અને આઈ-ક્રીએટ સેન્ટર તથા બાવળાના ઈ-રેડિએશન સેન્ટરની મુલાકાત લીધી હતી.

શ્રીલંકાના જનતા વિમુક્તિ પેરામુના નેતા અને સાંસદ શ્રી અનુરા કુમારા દિસનાયકાની અધ્યક્ષતામાં અન્ય સભ્યઓએ અમદાવાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓએ અમદાવાદના સાણંદના ટાટા મોટર્સ પ્લાન્ટ અને આઈ-ક્રીએટ સેન્ટર તથા બાવળાના ઈ-રેડિએશન સેન્ટરની મુલાકાત લીધી હતી.

પ્રસ્તુત કરાયો હતો. શ્રીલંકાના મહેમાનોએ આઈ-ક્રીએટ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. આ ઉપરાંત, મહાનુભાવોએ બાવળા ખાતે ગુજરાત એગ્રો ગામા રેડિએશન પ્રોસેસિંગ યુનિટની પણ મુલાકાત લીધી હતી. જ્યાં વિવિધ પાઘવસ્તુઓના રેડિએશનની સમગ્ર પ્રોસેસ નિહાળીને તેની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

શ્રીલંકાના ડેલિગેટ્સમાં જનતા વિમુક્તિ પેરામુના નેતા અને સાંસદ શ્રી અનુરા કુમારા દિસનાયકા, સાંસદ શ્રી વિજયા હેરાથ, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના સચિવ શ્રી ડો. નિહાલ અબેસિંઘે, નેશનલ પીપલ્સ પાર્ટીના આર્થિક પરિષદના સભ્ય શ્રી પ્રો. અનિલ જયંતા, ભારતીય ડાઈ કમિશન કોલંબોના કાઉન્સેલર શ્રી એલ્ડોસ મેથ્યુ પુનુજ અને ઝંઝઝના જન સંપર્ક અધિકારી શ્રી ચિટ્ટયાલા મહેશ સહિતના મહાનુભાવોએ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે થયેલા વિકાસ જોઈને પ્રભાવિત થયા હતા. સૌ મહેમાનોએ અમદાવાદ જિલ્લા સહિત રાજ્યમાં થયેલા વિકાસના કામોને વખાણ્યા હતા.

આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી ઝાલોદ ખાતે આર.બી.એસ.કે ટીમ દાહોદ જિલ્લા તેમજ સ્માઈલ ટ્રેનિંગના સહયોગ થી જન્મ જાત ફાટેલા હોઈ અને ફાટેલા તાળવા તેમજ પીડિયાટ્રિક સર્જરી માટે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ (સ્માઈલ ટ્રેન) દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બાવન જેટલા લાભાર્થીની નોંધણી કરવામાં આવી અને નવ જેટલા લાભાર્થીની સારવાર માટે તારીખ આપી જેમનું ઓપરેશન કરવામાં આવશે જે સંપૂર્ણ મફત સારવાર રેફરે તેમ ડૉ. વિવેક રાયઠલા એ જણાવ્યું હતું. વધુમાં સાથે કેમ્પમાં આવ્યું અને જરૂરિયાતમંદ દર્દીને કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં આવી પુખ્ત રાહત દરમાં સારવાર કરવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત દાહોદ જિલ્લા આર.બી.એસ.કે ટીમ દ્વારા સરાહનીય કામગીરી માટે મોમેન્ટો આપી સન્માન કરવા માં આવ્યું હતું.

# કેશરીયાજી દશામાં કોલેજ ઓફ નર્સિંગ-ઝાલોદ ખાતે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું



જય દશામાં વિદ્યાલયના પ્રિન્સિપાલ વિજયભાઈ કાપડિયા તેમજ નીરવસિંહ વાળા કેશરીયાજી દશામાં કોલેજ ઓફ નર્સિંગના અધ્યાપક નિસરતા દિવકલબેન તથા ચારેલ રચનાબેનની હાજરીમાં બાળકો પ્રત્યેની જાગૃતા, બાળકો પ્રત્યેની પારિવારિક લાગણીઓ, ટેકનોલોજીના યુગ પ્રમાણે બાળકો પાસે રહેલા મોબાઈલ ફોનનો કેવી રીતે વપરાશ કરવો, સમય બાબત, વગેરે મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

જય દશામાં વિદ્યાલયના પ્રિન્સિપાલ વિજયભાઈ કાપડિયા તેમજ નીરવસિંહ વાળા કેશરીયાજી દશામાં કોલેજ ઓફ નર્સિંગના અધ્યાપક નિસરતા દિવકલબેન તથા ચારેલ રચનાબેનની હાજરીમાં બાળકો પ્રત્યેની જાગૃતા, બાળકો પ્રત્યેની પારિવારિક લાગણીઓ, ટેકનોલોજીના યુગ પ્રમાણે બાળકો પાસે રહેલા મોબાઈલ ફોનનો કેવી રીતે વપરાશ કરવો, સમય બાબત, વગેરે મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

# અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વચ્ચે અલ ઉપસ્થિતિમાં ઘોળકા, દસ્ક્રોઈ, વિરમગામ, ધંધુકા અને સાણંદ ખાતે કાર્યક્રમો યોજાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) સહિત આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ યોજનાના આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આગામી તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજનાર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વચ્ચે અલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે યોજનાર છે. જેમાં

આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે. સમગ્ર રાજ્યની સાથે સાથે અમદાવાદ જિલ્લામાં પણ ૧૦મી ફેબ્રુઆરીના રોજ ઘોળકા, દસ્ક્રોઈ, વિરમગામ, ધંધુકા અને સાણંદ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના વિવિધ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે. જેમાં અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત કુલ ૫૮૧ આવાસોનું લોકાર્પણ તથા આંબેડકર આવાસ યોજનાના કુલ ૧૫૮ ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિત પંડિત દીનદયાળ આવાસ યોજનાના કુલ ૪૭ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે.

# રણીયારમાં કોળી સમાજ દ્વારા શ્રાવણ માતાજીનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો



જાલોદ તાલુકામાં રણીયાર ગામે કોળી સમાજ દ્વારા શ્રાવણ માતાજીનો ત્રી દિવસીય ઉત્સવ પાટોત્સવની ઉજવણી કરાઈ. પ્રથમ દિવસે કળશ પૂજન આરતી અને બીજા દિવસે નવચંડી પૂજન હવન આરતી તેમજ પોષ વધ બારસના દિવસે સમગ્ર રણીયાર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બાદમાં પૂજારીદુતિ પ્રસંગે આરતી બાદ મહાપ્રસાદ લઈ પ્રસંગની ઉજવણી પૂરી કરાઈ હતી. આ પ્રસંગે ગામના આગેવાન અને જાલોદ ઈસ્ટના વાઈસ ચેરમેન પપુભાઈ કોળી, સરપંચ, જી.સભ્ય, તા.સભ્ય સહિત સમગ્ર કોળી સમાજના અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રોગ્રામની ઉજવણીમાં કોળી સમાજના દૂર દૂર વસતા દરેક પરિવારો વતનમાં હાજર રહી તમામ ભાવિકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

# સૂત્રાપાડા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અંતર્ગત કાયદાકીય શિબિર યોજાઈ



જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ કાઉન્સિલ સ્ત્રીલ ટ્રેનિંગ સેન્ટર સૂત્રાપાડા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં દહેજ પ્રતિબંધ અધિકારશ્રી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કાયદા સંબંધિત તેમજ જો કોઈ મહિલા જાતિય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે જાણકારી આપી હતી. આ સાથે જ એક ટૂંકી પ્રતિકાર ફિલ્મનું નિદર્શન પણ ભાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી ફિલ્મ ઓફિસર દ્વારા પુરી પાડવામાં આવી હતી. અને Dhew જેન્ડર સ્પેસિયાલિસ્ટ, સખી વન સ્ટોપ સેન્ટર કાઉન્સેલર, ૧૮૧- અભયમ મહિલા હેલ્પ લાઈન કાઉન્સેલર વગેરે પ્રકલ્પોનાં કર્મચારીઓ દ્વારા જાતિય સતામણીનો ભોગ બનનારને આ બધા પ્રકલ્પો પીડિતાને કેવી રીતે મદદરૂપ થાય છે.

# ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા દરેક વિસ્તારોમાં પરમાર્થ અને સોશિયલ મીડિયા થકી લોકોને જાગૃત અપીલ કરાઈ

સ્વચ્છતા ન જાળવનાર લોકો પર કાયદેસર કાર્યવાહી કરવાની કાર્યવાહી કરાશે

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓને નગરપાલિકા દ્વારા નગરમાં માર્ક કરેલી તેમજ સોશિયલ મીડિયા થકી પ્રચાર કરી નગરને સ્વચ્છ રાખવા સૂચના આપી હતી. નગરના કેટલાક વેપારીઓ ધ્વારા ઝાલોદ નગરપાલિકામાંથી આવતા સફાઈ કામદાર ધ્વારા સફાઈ કરી તેમના ગયા પછી તેમની દુકાનમાંથી કચરો કાઢીને જાહેર રસ્તા ઉપર ફેંકી દેતા રોડ પર પાછો કચરો થઈ જવાની નોંધ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ છે. જેથી જો નગરમાં હવે પછી કોઈ પણ વેપારી જાહેર રસ્તા પર દુકાનનો કચરો ફેંકશે કે પોતાના દુકાનની આગળ ગંદકી કરશે તો નગરપાલિકા દ્વારા આવા વ્યાપારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરશે અને જો કાયદેસર કાર્યવાહી કર્યા બાદ પણ વ્યાપારી વારંધરી જાહેર

રસ્તા પર ગંદકી કરતા પકડાશે તો તેની દુકાન કાયમ માટે સીલ કરવામાં આવનાર છે. નગરમાં નાના નાના હાથલારી કે ચાની દુકાનો પણ પોતાની દુકાન પાસે ડસ્તબિન રાખે અને પોતાના વિસ્તારને ચોકબો રાખે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો છતાંય વારંધર ગંદકી કરનાર વ્યાપારી જો આવું કૃત્ય કરતા કોઈ વેપારી મલુમ પડશે તો તેઓના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેવી કે નોટીસ આપવી, દંડનીય કાર્યવાહી, વધુમાં જોઈ કોઈ વેપારી વારંધર આવું કૃત્ય કરતા પકડાશે તો તેઓનું દુકાન નું સી-સર્ટીફિકેટ રદ કરવામાં આવશે તથા દુકાનને હમંશા માટે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે. સદર કામગીરી કરવા નગરપાલિકાના સ્ટાફ સાથે કોઈપણ વેપારી ધ્વારા જો તકરાર કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

# મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશનથી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદના ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓ આસ્થા સ્પેશ્યલ ટ્રેન દ્વારા પહોંચશે



મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને બુધવારે રાત્રે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા, પ્રભુશ્રી રામચંદ્રજી પ્રત્યે ની અડગ શ્રદ્ધા અને સમર્પણ ના પરિણામે અયોધ્યા ના ભવ્ય રામમંદિર માં રમલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિર ના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદ થી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામ લલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશ્યલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ રવાના કરાવી હતી. આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીશ્રી એ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રા ની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો. સહકાર



રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, પ્રભારી શ્રી સંજય પટેલ, સહ કોષાધ્યક્ષ અને સહપ્રભારી શ્રી ધર્મેન્દ્ર શાહ તેમજ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

# ડાંગના ડી.ડી.ઓ.ને અપાયું બદલી વિદાયમાન

ડાંગના ડી.ડી.ઓ.ને અપાયું બદલી વિદાયમાન - રાજ્ય સરકારે તાજેતરમાં જ કેટલાક સનદી અધિકારીઓની જાહેર હિતમાં કરેલી બદલીના કારણે ડાંગમાંથી, જિલ્લા વિકાસ અધિકારી તરીકે માત્ર દસ માસની ફરજ બજાવ્યા બાદ વિદાય લઈ રહેલા શ્રી આર.એમ.ડામોરને, જિલ્લા વહીવટી તંત્રે ભાવભીનું વિદાયમાન આપ્યું હતું. પોતાના ડાંગ જિલ્લાના કાર્યકાળ દરમિયાન સાથી અધિકારી, કર્મચારીઓના મળેલા સહકાર બદલ, આભારની લાગણી પ્રગટ કરતા શ્રી ડામોરે, ડાંગ જિલ્લાની ટૂંકી ફરજ, તેમના માટે કાયમી સંભારણું બની રહેશે તેમ જણાવ્યું હતું. દરમિયાન ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા એવા કલેક્ટર શ્રી મહેશ પટેલે, જિલ્લા વહીવટી તંત્ર વતી શ્રી ડામોરને તેમની નવી જવાબદારીઓ બદલ શુભકામનાઓ પાઠવી, શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ



અર્પણ કર્યું હતું. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના વિદાય સમારંભમાં પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગણિયા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી સહિતના વરિષ્ઠ અધિકારીઓ, અને જુદી જુદી કચેરીઓના જિલ્લા અધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, શ્રી આર.એમ.ડામોરને ભાવભરી વિદાય આપી હતી.

# આજનું રાશિ ભવિષ્ય.....

**મેષ (અ,વ,ઇ) :** આજના દિવસે તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે. જો તમે પોતાના ઘર ના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લયી શકે છે. બાળકો રમતગમત તથા બહારની અન્ય પ્રવૃત્તિઓમાં વધુ સમય વેડફશે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે.

**વૃષભ (બ,વ,ઉ) :** આજના દિવસે તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તણા બિનજરૂરી રીતે આવી શકે છે. જે લોકોએ કોઈ અજણા વ્યક્તિ ના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકો ને આજે તે નિવેશ થી લાભ થવા ની પુરી શક્યતા છે. ઘરમાં કોઈક વિધી કરાવશો.

**મિથુન (ક,ઇ,ઘ) :** આજના દિવસે પત્નીના કામકાજમાં ચંચૂપાત કરશો નહીં, કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો.તમારા કામથી કામ રાખો એ જ સાડું છે. હસ્તલેખ જેટલો ઓછો એટલું સાડું અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજ કરવા માટે સારો દિવસ.

**કન્બા (પ,ઘ,ણ) :** આજના દિવસે તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અટકળ સમય મળશે. જે લોકો દુગ્ધ વેપાર થી સંકળાયેલા છે તે લોકો ને આજે લાભ થવા ની પ્રબળ શક્યતા છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે રોમાંન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો.

**તુલા (ર,ત) :** આજના દિવસે તમારી અંદર આજે જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે? નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજ માં આવી શકે છે કેમ કે કોઈ જુના નિવેશ થી તમને આજે લાભ થયી શકે છે. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સજી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છોડવાનું ટાળવું જોઈએ.

**કુંભ (ગ,શ,સ) :** આજના દિવસે આનંદમય દિવસ માટે માનસિક તણા અને તણાવ ટાળો. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યાં લાભની શક્યતા છે. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડીફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે.

**વૃશ્ચિક (ન,ય) :** આજના દિવસે મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેકગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પારી શકે છે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. પોતાની જાત પર દયા ખાવામાં સમય વેડફશો નહીં, એના કરતાં જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો. પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે.

**મીન (દ,ચ,ઝ,થ) :** આજના દિવસે ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. કોઈ નજીક ના મિત્રો થી અમુક વેપારીઓ ને સારું ધન લાભ થવા ની શક્યતા છે. આ ધન તમારી ઘણી મુશ્કેલીઓ ને દૂર કરી શકે છે. બાળકો તથા પરિવાર પર આજે તમારું ધ્યન કેન્દ્રિત રહેશે. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ.

## ત્રીજી ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલીને લઈને નવું અપડેટ સામે આવ્યું



। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ ।

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને ચોથી મેચમાં વિરાટ કોહલીના રમવા પર શંકા છે. એવું માનવામાં આવે છે કે તે રાજકોટ અને રાંચીમાં રમાયેલી મેચોમાં અનુપલબ્ધ રહેશે. પાવરફુલ બેટ્સમેન વિરાટ કોહલી આ સિરીઝની છેલ્લી બે મેચનો ભાગ બની શક્યો નથી. તેણે અંગત કારણોસર ટીમ મેનેજમેન્ટ પાસેથી રજા માંગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્ની અનુષ્ઠા શર્મા બીજી વખત માતા બનવા જઈ રહી છે. આ જાણકારી કોહલીના પાસ મિત્ર એમી ડી વિલિયર્સે આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીસીસીઆઈએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પારિવારિક બાબતોની વાત આવે છે, ત્યારે તે ક્રિકેટરની સાથે મક્કમતાથી ઊભું છે અને જ્યારે તે પરત ફરવા માટે તૈયાર થશે ત્યારે તે પરત ફરવા માટે તૈયાર રહેશે. વિરાટનો નિર્ણય છે. અત્યારે એવું લાગતું નથી કે તે આ સિરીઝમાં આગળ રમશે. બીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ બેન સ્ટોકસની આગેવાની હેઠળની ટીમ સામે ૧૦૬ રનથી શાનદાર જીત નોંધાવી અને સિરીઝ ૧-૧થી બરાબર કરી લીધી. હવે ટીમની નજર ત્રીજી ટેસ્ટ કબજે કરવા પર રહેશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ૧૫ જાન્યુઆરીથી રાજકોટમાં રમાશે. અત્યાર સુધી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ શ્રેણીની બાકીની ત્રણ મેચો માટે ટીમની જાહેરાત કરી નથી.

## દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયા વચ્ચે ચાલી રહેલી મેચમાં ક્રિકેટર હેનરી હંટ ઈજાગ્રસ્ત

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ ।

ઓસ્ટ્રેલિયાના મેદાન પર બનેલી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેદાન પર લોહી વહી ગયું, ખેલાડી ઘાયલ થઈને જમીન પર પડ્યો. હાલ એટલી ખરાબ થઈ ગઈ કે ખેલાડીને મેદાનની બહાર લઈ જવો પડ્યો. માર્શ કપની મેચ દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયા વચ્ચે હતી. ઝૂં ફોર્મટમાં રમાઈ રહેલી આ મેચમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરી, ત્યારબાદ જ્યારે લક્ષ્યનો પીછો કરી રહેલી વિક્ટોરિયાની ઈનિંગ અટકી ગઈ ત્યારે મેદાન પર આ ઘટના બની. સાઉથ ઓસ્ટ્રેલિયન ખેલાડી હેનરી હંટ સાથે ફિલ્ડિંગ કરતી વખતે આ ઘટના બની હતી. હવે સવાલ એ છે કે દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ખેલાડી હેનરી હંટનું શું થયું? તો થયું એવું કે વિક્ટોરિયાની ઈનિંગની ૨૫મી ઓવર ચાલી રહી હતી. વિક્ટોરિયન બેટ્સમેન થોમસ રોજર્સે એ જ ઓવરના બીજા બોલ પર શોટ રમ્યો, ત્યારબાદ બોલ બુલેટની ઝડપે બહાર આવ્યો. હવે આ કેચ થયો જોઈતો હતો કારણ કે બોલ સીધો હાથમાં જઈ રહ્યો હતો. હેનરી હંટ બોલ પકડવા ગયો અને બોલ સીધો તેના મોઢા સાથે અથડાયો. હેનરી હંટના ચહેરા પર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત હેનરી હંટ જ્યાં હતો ત્યાં જ જમીન પર પડી ગયો.

# ભારતનો સ્ટાર બોલર પુત્રીને લઈને ભાવુક થયો હજુ સુધી મને પુત્રીને મળવાની મંજૂરી નથી અપાઈ : મોહમ્મદ શમી

## શમી અને તેની પત્ની હસીન જહાં ૬ વર્ષથી અલગ રહે છે

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ ।

વન-૩ વર્લ્ડ કપ ૨૦૨૩માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલ ક્રિકેટના મેદાનથી દૂર છે. વર્લ્ડકપ પછી તે ઈજાથી રિકવર થઈ રહ્યો છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં શમી તેની દીકરીને લઈને ભાવુક થઈ ગયો હતો. શમીએ કહ્યું, “હું લાંબા સમયથી મારી પુત્રીને મળી શક્યો નથી કારણ કે મારી પત્ની તેને મળવા દેતી નથી. એક કાર્યક્રમમાં જ્યારે મોહમ્મદ શમીને તેની દીકરી આચરા વિશે પૂછવામાં આવ્યું તો તે ભાવુક થઈ ગયો હતો. મોહમ્મદ શમીએ કહ્યું કે, “હું મારી દીકરીને ખૂબ મિસ કરું છું, હું તેની સાથે વાત કરવાનો ઘણા પ્રયાસ કરું છું પરંતુ હું એટલું જ કરું છું જેટલી તે (હસીન જહાં) પરવાનગી આપે છે. આજ સુધી તેણે મને મારી દીકરીને મળવાની મંજૂરી આપી નથી.” મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં લગભગ ૬ વર્ષથી અલગ રહે છે. વર્ષ ૨૦૧૮માં હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા અને ત્યારથી તે શમીથી અલગ થઈ ગઈ હતી. શમી અને તેની પત્ની સાથે જોડાયેલો મામલો પોલીસ અને કોર્ટ સુધી પહોંચ્યો હતો. જો કે બાદમાં હસીન જહાં અલગ થઈ ગઈ અને શમીની દીકરી હસીન જહાં સાથે રહે છે. મોહમ્મદ શમીના અંગત જીવનમાં જ્યારે આટલી



ઉચ્ચપાથલહતીત્યારેતેભારતીયટીમમાંથીપણબહારથઈગયોહતો. પરંતુ શમીએ તે પછી વાપસી કરી અને વન-૩વર્લ્ડ કપ ૨૦૧૮માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્ષ ૨૦૨૩માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી ભારતીય ટીમ માટે સૌથી સફળ બોલર બન્યો હતો. શમીએ માત્ર ૪ મેચમાં ૨૪ વિકેટ ઝડપી હતી.



## ઈંગ્લેન્ડ સામે પેસરનો શાનદાર દેખાવ બુમરાહની ઈન્સ્ટાગ્રામની પોસ્ટથી લોકો મૂંઝવણમાં

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ ।

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેના શાનદાર પ્રદર્શન બાદ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલર બની ગયો છે. આઈસીસીએ ગઈકાલે ટેસ્ટ રેકિંગ જાહેર કરી હતી જેમાં બુમરાહ નંબર-૧ ટેસ્ટ બોલર બન્યો હતો. પરંતુ રેકિંગ જાહેર થયા બાદ બુમરાહને ઈન્સ્ટાગ્રામ પર કંઈક એવું પોસ્ટ કર્યું, જેણે બધાને મૂંઝવણમાં મૂકી દીધા અને બધા પૂછવા લાગ્યા કે બુમરાહ કોના પર નિશાન સાધી રહ્યો છે. જસપ્રીત બુમરાહે એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી, જેમાં બુમરાહે તે પ્રશંસકો પર નિશાન સાધ્યું છે જેઓ ખરાબ સમયમાં તેની સાથે ઉભા નથી રહ્યા. બુમરાહની આ પોસ્ટને કટાક્ષ તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે જસપ્રીત બુમરાહને થોડા સમય પહેલા મૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો, જ્યારે તે ઈજામાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે, સોશિયલ મીડિયા પર એવા મીસ બનાવવામાં આવ્યા હતા કે બુમરાહ ફક્ત IPL દરમિયાન જ ફિટ હોય છે, બાકીનો સમય તે ઈજાથી પીડાય છે અને તેથી તે ભારતીય ટીમ માટે નથી રમી રહ્યો. હવે જ્યારે જસપ્રીત બુમરાહ ઈજામાંથી વાપસી કરીને ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને ત્રણેય ફોર્મટમાં નંબર ૧ બનાવનાર ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે.

# પીટરસનના મજાક પર ઝહીર ખાને આપ્યો જડબાતોડ જવાબ

। (એજન્સી) નવી દિલ્હી, તા.૮ ।

વિશાખાપટ્ટનમમાં ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચના ચોથા દિવસે કેવિન પીટરસન અને ઝહીર ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને એક-બીજાને ટોન્ટ મારતા જોવા મળ્યા હતા. અંતે બંને વચ્ચે વાતચીત થઈ અને બંનેએ મઝાકિયા અંદાજમાં વાત પૂરી કરી હતી. પીટરસને મહેન્દ્ર સિંહ ધોનીનું

મજાક ઉડાડ્યું હતું. ઝહીરે યુવરાજ સિંહનું નામ લઈને જોરદાર જવાબ આપ્યો હતો. પીટરસનનું કહેવું હતું કે, તેણે ટેસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીને આઉટ કર્યાં છે અને તેની વિકેટોની લિસ્ટમાં પાકિસ્તાનના કામરાન અકમલનું નામ પણ છે. આ નિવેદન પર ઝહીર ખાને પીટરસનને યુવરાજની ધીમી સ્પિન સામે તેનો સંઘર્ષ યાદ અપાવ્યો

હતો. પીટરસન અને ઝહીર ભારત-ઈંગ્લેન્ડની બીજી ટેસ્ટ દરમિયાન કોમેન્ટરી કરી રહ્યા હતા. પીટરસને વર્ષ ૨૦૦૭માં ઓવલમાં રમવામાં આવેલી ટેસ્ટમાં ધોનીને ૮૨ રન પર આઉટ કર્યો હતો. તે વાતચીત દરમિયાન તેની જ ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના વચ્ચે ઓફ-ફીલ્ડ સ્વેલિંગની ઘટના બની હતી. પીટરસને કહ્યું- તમે જાણો છો કે મારા ખિસ્સામાં બીજું કોણ છે? મહાન મહેન્દ્ર સિંહ ધોની. તે મારા ખિસ્સામાં કામરાન અકમલની બાજુમાં છે. આના પર ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે તરત જ જવાબ આપ્યો - તમે જાણો છો કે હું તાજેતરમાં યુવરાજ સિંહને મળ્યો હતો અને તે કેવિન પીટરસન તેના ખિસ્સામાં હોવાની વાત કરી રહ્યો હતો.

## વિશેષ

### સામાજિક-પારિવારિક પ્રસંગોની ઉજવણી પ્રસંગે વૃદ્ધરોપણ કરી તેના જતનનો સંકલ્પ કરીએ

# ખંભાત ખાતે રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ

। (માહિતી) આણંદ ।

ખંભાત ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે, ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા રાસાયણિક ખાતર અને દવાના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થયો છે, એટલું જ નહીં પરંતુ રાસાયણિક ખાતર- દવાના કારણે પ્રકૃતિનું સંતુલન જાળવવા જીવજંતુ-બેક્ટેરિયાનાશ પામ્યા છે, જેના પરિણામે આજે ધરતી બંજર બની રહી છે. ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે. આપણે હવા, પાણી અને જમીનને પ્રદુષિત કરીને પ્રકૃતિનું શોષણ કર્યું છે, જેનો દંડ પ્રકૃતિ આપી રહી છે. ગત વર્ષે આવેલા બે વાવાઝોડા તેના સાક્ષી છે. પ્રકૃતિને બચાવવા પ્રાકૃતિક ખેતી જ એક માત્ર અસરકારક હથિયાર સાબિત થઈ શકે એમ છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌને ગુરુદક્ષિણા રૂપે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી.

ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ અને પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય દ્વારા ખંભાત ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતા રાજ્યપાલશ્રી દેવવ્રતે ઉપસ્થિત તમામને સામાજિક-પારિવારિક પ્રસંગોની ઉજવણી પ્રસંગે એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવા અનુરોધ કરતા ઉમેર્યું હતું કે, વૃક્ષ વાવી તેનું ૩ વર્ષ સુધી રક્ષણ કરશો તો તે વૃક્ષ આખી જિંદગી તમારું રક્ષણ કરશે. વૃક્ષો વાતાવરણમાંથી ઝેરરૂપી કાર્બન ડાયોક્સાઈડ લઈને આપણને અમૃતરૂપી ઓક્સિજન આપે છે. આથી જ વૃક્ષોનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે.



પ્રાકૃતિક ખેતીનું આ અભિયાન જન માનસ સુધી પહોંચે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે, ત્યારે સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે ખૂબ જ જરૂરી છે, અને આજના સમયની માંગ પણ છે, તેમ જણાવીને પ્રાકૃતિક કૃષિના ફાયદા વર્ણવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ગ્લોબલ વોર્મિંગમાં સતત વધારો થઈ રહ્યો છે, તેવા સમયે ધરતી માતાને બચાવવા પ્રાકૃતિક કૃષિએ અસરકારક શસ્ત્ર સાબિત થઈ શકે છે. પ્રાકૃતિક કૃષિ માટે વપરાતા ગાયના એક ગ્રામ છાણમાં ત્રણ સો કરોડ થી વધુ સૂક્ષ્મ જીવાણુ હોય છે. ભારતીય મુળની ગાયોનું છાણ બેક્ટેરિયા અને ગૌમુત્ર બનીજનો ભંડાર છે. જેનાથી બનતા જીવામૃતમાં દર ૨૦ મિનિટે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં બમણો વધારો થાય છે, આ જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાથી જમીનના સેન્ટ્રીય કાર્બનમાં વધારો થવાની સાથે જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.

રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું હતું કે, ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના વપરાશને કારણે

જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ ઘટતાં ઓર્ગેનિક કાર્બન ઓછો થયો છે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ વધે છે એટલું જ નહીં, જમીનના ઓર્ગેનિક કાર્બનમાં પણ ઝડપથી વધારો થાય છે. હરીત કાંતીના સમયે સમગ્ર દેશની જમીન જંગલ જેવી ઉપજાવ હતી. તે સમયે જમીનનો સેન્ટ્રીય કાર્બન ૨ થી ૨.૫ ટકા હતો, જે હવે ઘટીને ૦.૨ થી ૦.૫ ટકા થઈ ગયો છે. જેનો અર્થ થાય છે કે હવે દેશની જમીન બિન ઉપજાઓ બની ચૂકી છે. રાજ્યપાલશ્રીએ ખેતીમાં વપરાતા યુરિયામાં રહેલા નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડથી ૩૧૨ ગણો વધુ નુકશાનકારક છે જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, ગત વર્ષે દેશમાં ૩.૨૫ લાખ કરોડના યુરિયાની આયાત કરવામાં આવી છે. આપણે ૩.૨૫ લાખ કરોડ રૂપિયા આપીને વિદેશમાંથી ઝેર ખરીદીએ છીએ. તેની સામે જો પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો પ્રકૃતિની સાથે દેશના રૂપિયાને પણ બચાવી શકીએ. યુરિયા ખાતરમાં ૫૦ ટકા નમક હોય છે જે જમીનને કઠણ અને બિન ઉપજાવ બનાવે છે, જ્યારે પ્રાકૃતિક

ખેતીના કારણે જમીનમાં અળસિયાની સંખ્યા વધે છે, જે નેચરલ વોટર હાર્વેસ્ટિંગનું કામ કરે છે જેના કારણે જમીનમાં પાણીનું સ્તર પણ ઊંચું આવે છે. રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભગવત ગીતામાં લખ્યું છે કે આહાર શુદ્ધિથી જ મનની શુદ્ધિ થાય છે. માટે આપણો ખોરાક પોષકતત્વોથી ભરપુર હોવો જોઈએ. પરંતુ રાસાયણિક દવા અને ખાતરના કારણે આજે અનાજ શાકભાજીમાં પોષકતત્વો નોંધપાત્ર રીતે ઘટ્યા છે. આવા રાસાયણિક દવા અને ખાતરથી ઉત્પાદિત અનાજ-શાકભાજી ખાવાથી હવે નાની ઉંમરે હાર્ટ એટેક ડાયાબિટીસ કેન્સર જેવી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. આજથી ૩૦-૪૦ વર્ષ પહેલા કોઈપણ જાતની ગંભીર બીમારી થતી નહોતી. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટવાની સાથે તેમાંથી ઉત્પન્ન થતા ધાન્ય પાકો પણ ઝેરયુક્ત બન્યા છે. ગુજરાતના વન લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવીને રાજ્યપાલશ્રીએ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માતાને બચાવવાના આ મહાવિજ્ઞાન જોડાય તે માટે

ગુજરાતના હાલોલમાં વિશ્વની સૌ પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી ડૉ. સી.કે. ટીબીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના સેક્રેટરીશ્રી બંકિમચંદ્ર વ્યાસે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જ્યારે કોલેજના આચાર્યશ્રી વશિષ્ઠ દિવેદીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીના હસ્તે રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના સેક્રેટરીશ્રી બંકિમચંદ્ર વ્યાસ દ્વારા લીખીત આવેલ બે પુસ્તકોનું રાજ્યપાલશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. તથા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વૈજ્ઞાનિકો અને ખેડૂતોને સન્માનવામાં આવ્યા હતા. આ તકે સંચર્ય મહાનુભાવો તથા ઉપસ્થિત સર્વેએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાના શપથ લીધા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અતુલકુમાર બંસલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. નિરંજનભાઈ પટેલ, પ્રોબેશનરી આઈ.એ.એસ. શ્રી મહેક જૈન, પ્રાંત અધિકારીશ્રી નિરૂપા ગઢવી, ખંભાત નગરપાલિકા પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ પરમાર, શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખશ્રી જયંતીભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી કમલેશભાઈ ભ્રમભટ્ટ, પ્રાકૃતિક કૃષિ પ્રચારકશ્રી પ્રદુલભાઈ સંજલીયા, યુનિવર્સિટી અને કોલેજના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા ખેડૂતો ઉપસ્થિત હતા હતા.

ન્યૂઝ બ્રિફ

અમદાવાદ એરપોર્ટ પર વેલેટ પાર્કિંગની સુવિધાની શરૂઆત

1 (એજન્સી) અમદાવાદ, તા.૮ । અમદાવાદ એરપોર્ટ પર વાહનો લઈ જતા લોકો માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ એરપોર્ટ પર વેલેટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે તમને થાય કે આ વેલેટ પાર્કિંગ સુવિધા એટલે શું? મતલબ કે વેલેટ પાર્કિંગમાં જે તે કર્મચારી જ વાહન પાર્ક કરશે અને માલિકને આપી જશે. જોકે વેલેટ પાર્કિંગ માટે ચાર્જ પણ નક્કી કરાયો છે. જેથી હવે વેલેટ પાર્કિંગને કારણે વાહનચાલકોને વાહન પાર્ક કરવામાં સરળતા રહેશે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દરરોજ અનેક મુસાફરો આવતા હોય છે. જેમાં કોઈને લેવા અને મૂકવા માટે પણ અનેક લોકો વાહન લઈને આવતા હોય છે. જોકે હવે અમદાવાદ એરપોર્ટ પર વાહનો લઈને જતા લોકો માટે એરપોર્ટ પર વેલેટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી હતી. વેલેટ પાર્કિંગમાં કર્મચારી જ વાહન પાર્ક કરશે અને માલિકને આપી જશે. વેલેટ પાર્કિંગ માટે એક કલાકના રૂપિયા ૧૫૦ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સુંબઈમાં વેલેટ પાર્કિંગની સુવિધાને સારો પ્રતિસાદ મળતા અમદાવાદમાં સુવિધા શરૂ કરવામાં આવી. જોકે હવે અમદાવાદ એરપોર્ટ વેલેટ પાર્કિંગની સુવિધા ધરાવતું દેશનું ચોથું એરપોર્ટ બન્યું છે.

અમદાવાદના માંડલ બાદ પાટણના રાધનપુરમાં અંધાપાકાંડ

1 (એજન્સી) રાધનપુર, તા.૮ । રાજ્યમાં વધુ એક આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારીનો આંધાપાકાંડ સામે આવ્યો છે. અમદાવાદના માંડલ બાદ પાટણના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલ ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. જેમાં ૧૩ દર્દીના ઓપરેશન બાદ ૫ દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે. પાટણના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ અંધાપાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૨ મહિલા અને ૩ પુરુષને આંખમાં ચેપ લાગ્યો છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દીને અંધાપો આવ્યો છે. જે બાદ દર્દીઓને અમદાવાદ ખાતે અસારવા આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગઈકાલે ગાંધીનગર અને અસારવા આંખની હોસ્પિટલની ટીમ રાધનપુર ખાતે તપાસમાં પણ ગઈ હતી. જે તપાસમાં ૫ દર્દીઓને આંખમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું. અત્રે જણાવે છે કે, ૨ ફેબ્રુઆરીના રોજ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં ૪૫ વર્ષ અને ૬૫ વર્ષીય રાધનપુરની મહિલાને દ્રષ્ટિમાં ખામી સર્જાઈ છે. ૭૮ વર્ષના સાંતલપુરના પુરુષ, ૭૦ વર્ષના રાધનપુરના પુરુષ અને ૬૫ વર્ષીય કાંકરેજના પુરુષને આંખમાં તકલીફ થઈ છે.



અમદાવાદમાં પવનના કારણે ઘુળની કમરીઓ ઉડી રહે છે.

ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ મેળવતી અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

1 (એજન્સી) અમદાવાદ, તા.૮ । મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મેયર શ્રીમતી પ્રતીભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે BSE બેલ રીંગીંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સરેઈનબલ અને એન્વાયરમેન્ટ ફેન્ડલી ડેવલપમેન્ટ માટે આપ્યું છે તેને અમદાવાદ મહાનગર પાલિકાએ આ રૂ. ૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે. અમદાવાદ મહાનગર પાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવપૂર્ણ મેળવ્યું છે. અમદાવાદ મહાનગરમાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના વિકાસ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ માટે આ ગ્રીન બોન્ડ



ઉપયુક્ત બનશે. અમદાવાદમાં સ્યુએજ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિફ્ટિંગ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બોન્ડ ઈસ્યુ બહાર પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ. ૨૦૦ કરોડના રાજ્યના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બીડીંગ ૫ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સવારે

ખેડૂતોને પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ ફરી એકવાર પેદા થઈ માર્કેટિંગ ચાર્જમાં મરચાંના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો આ પહેલા મરચાંનો ભાવ ૫૦૦૦ થી ૬૦૦૦ સુધીનો હતો, તે ઘટીને ૨૦૦૦ થી ૩૦૦૦ સુધીનો થઈ ગયો છે

1 (એજન્સી) રાજકોટ, તા.૮ । રાજકોટમાં ફરી એકવાર ખેડૂતોને ૨૩વાનો વારો આવ્યો છે. ડુંગળી પકવતાં ખેડૂતો બાદ હવે મરચાંના ખેડૂતો રડી રહ્યાં છે. હાલમાં ગોંડલ બાદ રાજકોટ માર્કેટિંગ ચાર્જમાં મરચાંની મોટા પ્રમાણમાં આવકો થઈ રહી છે, પરંતુ ભાવોમાં ગયા વર્ષ કરતાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે, આ ઘટના ભાવોને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ પહેલા ડુંગળીના ખેડૂતોની સાથે પણ આ જ સ્થિતિ ઉભી થઈ હતી. હાલમાં રાજકોટમાં એક જ દિવસમાં ૧૨,૫૦૦ ભારી કરતાં વધારે મરચાંની આવકો થઈ રહી છે. દેશી મરચા કરતા હવે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ ચાર્જમાં સાનિયા, રેવા ૭૦૨ મરચાંની પુષ્કળ આવકો થઈ છે. ગયા વર્ષે ચાર્જમાં એક મણ મરચાંના ૫૦૦૦ થી ૬૦૦૦ ભાવ હતા, તે આ વર્ષે ૫૦ ટકા ઘટ્યા છે. હાલમાં ૨૦૦૦ થી ૩૨૦૦ રૂપિયા ખેડૂતોને એક મણના ભાવ મળી રહ્યા છે. સોરાષ્ટ્રમાં સૌથી વધુ ગોંડલ સહિતના વિસ્તારોમાં મરચાંનું વાવેતર થાય છે. રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં

પણ મરચાંનું વાવેતર છે. રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ ચાર્જમાં મરચાંની મબલખ આવક થઈ. મરચાંની ૮૫ હજાર ભારીની આવકથી ચાર્જ ઉભરાયું હતું. ચાર્જ બહાર મરચાં ભરેલા ૧૭૦૦ થી ૧૮૦૦ વાહનોની લાંબી કતાર જોવા મળી છે. અમુક ખેડૂતો તો લુપ્ત થતા બળદગાડામાં મરચાં વેચવા માટે ચાર્જમાં આવ્યા હતા. ગગડતી બજાર વચ્ચે હરાજીમાં મરચાંના ૨૦ કિલોના ભાવ એક હજારથી ત્રણ હજાર ૩૦૦ સુધી બોલાયા હતા. અત્યાર સુધીમાં મરચાંના ભાવમાં રૂપિયા બે હજારનો ઘટાડો નોંધાયો છે. ડુંગળીની નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાતા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજા બાજુ ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે. ડુંગળીના ભાવ તળિયા આવી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો બીજા તરફ ગ્રાહકો બજારમાંથી મોંઘા ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે. નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો એક કિલો ડુંગળી માત્ર પાંચ રૂપિયામાં વેચી રહ્યા છે. પરંતુ તે જ ડુંગળી જ્યારે મુલ્લા બજારમાં આવે છે.

કાપોદ્રામાં જાહેર રોડ પર ચુવતી પર ચપ્પુ વડે હુમલો કરાયો

1 (એજન્સી) સુરત, તા.૮ । સુરત શહેરના કાપોદ્રામાં જાહેર રોડ પર ચુવતી પર ચપ્પુ વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ચુવતીએ મિત્રતા રાખવાની યુવકને ના પાડતા ચપ્પુથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં થયેલા ગ્રીષ્મા હત્યાકાંડની ઘટના આજે પણ લોકો ભૂલી શક્યા નથી. એક તરફી પ્રેમમાં યુવાને જાહેરમાં જ ચુવતી પર ચપ્પુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી, ત્યારે ફરી એક વાર આવી જ ઘટના બનતા રહી ગઈ છે. મળતી વિગત પ્રમાણે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને વેસુની કોલેજમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષીય ચુવતી પર ચપ્પુથી હુમલો કરવાની ઘટના સામે આવી છે.

૨૦૧૮માં જંગલેશ્વર ખાતે રેડ પાડી હતી જમ્મુથી ચરસનો જથ્થો મંગાવનાર આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી

1 (એજન્સી) રાજકોટ, તા.૮ । રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એનસીબી અમદાવાદ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ૨૦૧૮માં જંગલેશ્વર ખાતે રેડ પાડી હતી. જે રેડમાં ચરસનો જથ્થો મંગાવનાર મહેબૂબ ઠેબા તેમજ ચરસ રાખવા બદલ ઈલિયાસ સોરા, જાવેદ દલ અને રફીક લોયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ચરસનો જથ્થો પહોંચાડનારા શકીલ સૈફીની પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારના રોજ અધિક સેશન્સ જજ બીબી જાવેદ દ્વારા ચાર આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી છે. તેમજ પ્રત્યેકને રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપી શકીલ સૈફીને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવેલ છે. પબ્લિક પ્રોસિક્યુટર સંજય વોરાના જણાવ્યા પ્રમાણે,

૨૦૧૮ના નવમા મહિનામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદને માહિતી મળી હતી કે શકિલ અને સોહિલ નામના વ્યક્તિ રાજકોટ ખાતે મહેબૂબ નામના વ્યક્તિને ચરસ ડિલિવરી કરવા ગયા છે. જે માહિતી મળતાની સાથે રાજકોટ એસોજી દ્વારા જુદા જુદા વ્યક્તિઓના ફોન કોલ રેકોર્ડ તપાસતા જણાવા મળ્યું હતું કે, મહેબૂબ ઠેબા નામની વ્યક્તિ જંગલેશ્વર વિસ્તારમાં રહે છે અને ત્યાં ચરસનો જથ્થો ડિલિવર થયો છે. જેથી એસોજીની ટીમ દ્વારા મહેબૂબ ઠેબાના ઘરે તપાસ હાથ ધરવામાં આવતા ઈલિયાસ સોરા પણ મળી આવ્યો હતો. તેમજ તેની પાસેથી ચરસના ગણ પણ મળી આવ્યા હતા. તો સાથે જ મકાનના ઉપરના ભાગે જાવેદ દલ પણ મળી આવ્યો હતો. જેના બાથરૂમના ઉપરના ભાગેથી થેલામાંથી બે કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

મિત્રની ગાડી લઈને નીકળેલા નબીરાઓએ કાર નીચે દંપતીને કચડ્યા

1 (એજન્સી) સુરત, તા.૮ । સુરતના કામરેજ નજીક પાસોદરા પાટિયા પાસે મોડી રાત્રે લકઝરિયસ કાર ચાલકે બાઈક પર સવાર દંપતીને અડફેટે લીધા હતા. ચાર ગાડીમાં સવાર ૫ યુવકોએ બેકામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે. હાલ દંપતી સુરત પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજા તરફ, કારમાં સવાર ૫ પેકી ૩ યુવકો અકસ્માત સર્જીને ભાગી ગયા હતા અને ૨ યુવકોને સ્થાનિકોએ પોલીસ જેલ હવાલે કર્યાં છે. હાલ મયુર મુકેશ સોલંકી અને કેવિન જયંતિ રાહડિયાને સ્થાનિકોએ પોલીસ હવાલે કર્યાં હતા. પ્રાથમિક તપાસમાં બંને પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નહિ હોવાનું જાણવા મળ્યું છે.

નવી આશા, નવી સફર, IVFની મદદથી આશાને ઉકિતમાં ફેરવો.

# MERRYLAND

Women's Hospital & IVF (દેસ્ટ ટ્યુબ બેબી) સેન્ટર

રાહત હરે IVF પેકેજ/ઓપરેશન 0% વ્યાજદરે EMI સુવિધા ઉપલબ્ધ

**કેમ્**

સૌથી ઓછા પ્રયત્ને ૪૬૫૫ ગર્ભધારણ માટે

- કારણ વગરના ઓવમપિક-અપ અને એમ્બ્રીયો ટ્રાન્સફરને રોકવા
- ઓછામાં ઓછા પ્રયત્ને ગર્ભધારણ મેળવવા
- ગર્ભપાતની શક્યતા ઓછી કરવા
- સૌથી સચોટ પદ્ધતિનો ઉપયોગ

નિશુલ્ક વ્યંધત્વ નિદાન કેમ્ તા. ૧૫-૦૨-૨૦૨૪ સુધી સમય સવારે ૧૧ થી સાંજે ૬ સુધી

**જટિલ સમસ્યાઓનાં નિવારણ માટે**

- IUI કે IVF માં એકથી વધુ વાર નિષ્ફળતા
- 0% કે નહીવત શુક્રાણુ
- લાંબુ કે જટિલ વ્યંધત્વ
- ગમે તેવી મોટી ઉંમર કે નીચું AMH
- PCOD સહી બીજા ન બનવા કે છૂટા ન પાડવા
- બંને નળીઓ બંધ હોવી
- ગર્ભશયમાં ગાંઠ હોવી
- એન્ડોમેટ્રીઓસીસ
- એડેનોમાયોસીસ

**ઉપલબ્ધ સેવાઓ**

- દાઈલિસ્ટ પ્રેગનેન્સી ચુનિટ
- IUI, IVF સરોગેસી
- હિસ્ટ્રોસ્કોપી-લેપ્રોસ્કોપી
- દાઈલિસ્ટ પ્રેગનેન્સી
- મેલ/ફિમેલ ઈનફર્ટીલીટી

દરેક ઈન્સ્યોરન્સ માટે કેશલેશ સુવિધાઓ ઉપલબ્ધ

ડો. હિતેશ પટેલ રજીસ્ટ્રેશન ફિ પણ ફરજિયાત, તો કોલ કરો.. (ઈનફર્ટીલીટી સ્પેશ્યાલિસ્ટ) + 91 9081 66 33 55 / 66

સરનામુ :- શ્રીજી માળ, ડ્રીમસ્કવેર, નિર્ણયનગર અંડરવૃજની બાજુમાં, અખબારનગર, અમદાવાદ, ગુજરાત, [www.merrylandhospital.com](http://www.merrylandhospital.com)

VS Hair Salon

97258 56958

Ramesh, Vishnu

2, Kadamb Complex, Judges Bungalow Road, Nr. Rajvansh Tower, Bodakdev, Ahmedabad - 380 054